

જાગ્રત્તિ સંદેશ

Price : 5/-

Total Page : 36

JAGRUTI SANDESH

Vol 14 Issue No. 10 - Mumbai October 2014

પરસ્પર પરિયાં અને ગ્રેભાયી પાંગરતો પરિવાર



સત્યમેવ જયતે

The Make in India logo is derived from India's national emblem. The wheel denotes peaceful progress and dynamism - a sign from India's enlightened past, pointing the way to a vibrant future. the prowling lion stands for strength, courage, tenacity and wisdom- values that are every bit as Indian today as they have ever been.

MAKE IN INDIA

કુલ્લી ફર્નિશેડ લકજરી હોમ્સ ₹ 15* લાખ કરતાં ઓછી કિંમત





શો ફર્નિટની ખરેખરી તસવીર (લિવિંગ એરિયા)



શો ફર્નિટની ખરેખરી તસવીર (બેડરમ)



જેણ મંદિર



દરેક માટે લાઇફસ્ટાઇલ સુખસુવિધાઓ

- કલબહાઉસ અને પૂલ
- રેસટોરંટ
- સ્પા અને ફિટનેસ સેન્ટર
- ઈંજોર બેડમિન્ટન કોર્ટ
- સાઈકલિંગ ટ્રૂંક અને જોર્જિંગ પાથ
- ચિયલ્ફૂન્સ પણ એરીયા
- સીનિયર સિટિઝન સિટ્-આઉટ



પાલી-ખોપોળી રોડ પર મુંબઈ થી
2 કલાકથી પણ ઓછા અંતરે

- વાશી - 68 કિમી
- થાણે - 82 કિમી
- દાદર - 88 કિમી
- અંધેરી - 91 કિમી
- જૈન દેરાસર - 1 કિમી
- અંડલંબ ઇમેજિકા - 13 કિમી
- પાલી બદાલેશ્વર મંદિર - 16 કિમી (સાઈટ પણી)

જેણ જાગૃતી સેન્ટર ના સભ્યો માટે ખાસ ઓફર.
15 જૂન 2014 પેહલા બુક કરો અને મેળવો 10 ગ્રામ સોના નો સિક્કો, મફત.

ADVT

પ્રોજેક્ટ અપ્સુલ હ્રાસ

ઇન્ડિયન ઓવરસીઝ બેંક
Indian Overseas Bank
Good people to grow with

સાઈટ ઓફિસ : જાંલુલપાદ, પદધવલી, પાલી - ખોપોળી રોડ, વિ. રાયગઢ, મહારાષ્ટ્ર. • સેટ્સ ઓફિસ : 408, મેડોઝ, સંહાર પલાજા, કે.લી. નગર, અંધેરી (પુ.), મુંબઈ - 59. *બેંક યુનિટ પ્રાધિક. જેણે અન્ય ચાર્ટરેડ બેંક યુનિટ્સની સામેની અન્ય સુવિધાઓની ખર્ચ બેંકિક યુનિટ કિન્નરાની સામેની અન્ય સુવિધાઓની ખર્ચ બેંકિક યુનિટ કે અને ડેયલપર હ્રાસ માત્ર બેંક વારાના નેસિસ પર પૂરો પડાશે. ખરેખરી તસવીર લખ્યું છે એ છોડીને દર્શાવેલી બધી જ તસવીરો માત્ર નિર્ણય આપ્યું છે. વિવરણો, પતાનાની, ડિક્ઝાઇની, લેનાઉટો, સગપડો, એમેન્જિનીઝ વગેરે કોઈપણ પૂર્વ-સૂચના વગર ફરજારાને આધિન છે. નિયમો અને શરતો લાગુ.

કૉલ કરો : 022 - 40272829, +91 98696 49863.

www.nirvanaalive.in • info@nirvanaalive.in



જૈન જાગૃતિ સેન્ટર સેન્ટ્રલ બોર્ડ

જાગૃતિ સંદેશ

૨૦૧, માથાડું આર્કેડ, સુભાષ રોડ, વિલેપાર્લો (પૂર્વ),
મુંબઈ-૫૭. ફોન: ૯૮૨૯૩૦૩૮/૬૪૭૨૬૬૩૬
www.jainjagruti.com
E-mail: admin@jainjagruti.com
editor@jainjagruti.com

માનદ તંત્રી : શ્રી રમેશ એમ. સંઘવી
સહિતંત્રી : શ્રી અશોક એ. શાહ

કેન્દ્રિક કમિટી

ચેરમેન	: શ્રી રમેશ જે. મોરબિયા
તા.ભૂ.પૂ.ચેરમેન	: શ્રી જિતેન્દ્ર એસ. કોઠારી
ફાઉન્ડર ચેરમેન	: શ્રી ચીમનલાલ એસ. ગોસલિયા
વાઇસ ચેરમેન	: શ્રી સંજય બી. શાહ શ્રી દીનેશ એલ. નાણાવટી
સેકેટરી જનરલ	: શ્રી પ્રકુળ વી. કામદાર
સેકેટરી	: શ્રી કિશોર એસ. શેઠ શ્રી જ્યંતીલાલ કે. છાડવા શ્રી ઉદય ડી. સંઘવી શ્રી દ્વિજેશ પી. શાહ
ડેવલપમેન્ટ સેકેટરી	: શ્રી અનિલ જી. દોશી
ખજાનાની	: શ્રી રાજેશ સી. ગાંધી શ્રી રાજેશ આર. ભણસાલી
તંત્રી	: શ્રી રમેશ એમ. સંઘવી

જેજેસી-સેન્ટ્રલ બોર્ડ ચેરિટેબલ ટ્રસ્ટ-કમિટી

ચેરમેન	: શ્રી કિશોર એન. શાહ
તા.ભૂ.પૂ.ચેરમેન	: શ્રી કિરણ એચ. શાહ
વાઇસ ચેરમેન	: શ્રી ચંદ્રવદન આર. શાહ
વાઇસ ચેરમેન	: શ્રી રમેશ જે. મોરબિયા
સેકેટરી	: શ્રી જિતેન્દ્ર એસ. કોઠારી
સેકેટરી	: શ્રી સંજય બી. શાહ
જો. સેકેટરી	: શ્રી પ્રકુળ વી. કામદાર
ખજાનાની	: શ્રી હસમુખ કે. દેટિયા
સહખજાનાની	: શ્રી અનિલ જી. દોશી શ્રી અભિયાનમાં ફાળોઓ : શ્રી પ્રવીણ જી. શાહ શ્રી કમલેશ સી. શાહ શ્રી કિશોર એસ. શેઠ શ્રી હર્ષદ જે. ગાંધી શ્રી જ્યંતી કે. છાડવા શ્રી નીતિન એમ. સંઘવી શ્રી રસિક એન. કોઠારી શ્રી શેલેશ ડી. શાહ શ્રી રાજેશ આર. ભણસાલી શ્રી રાજેશ સી. ગાંધી શ્રી પ્રવીણ એ. શાહ શ્રી રવજી જી. ગાલા શ્રી રમેશ એમ. સંઘવી

- પત્રિકામાં પ્રગત થતા લેખો કે વિચારો લેખકના અંગત છે. તેની સાથે સંસ્થા કે તંત્રી સહમત છે એમ માની લેવું નહીં.
- કાનૂની કાર્યવાહીનું અધિકાર ક્ષેત્ર મુંબઈ રહેશે.

છૂટક મૂલ્ય રૂ.૫/- વાર્ષિક લવાજમ રૂ.૫૦/-



Message From The
CHAIRMAN.....

પ્રિય સ્નેહાદ સભ્યો,

જ્ય જિનેન્દ્ર,

નૂતન વર્ષાભિનંદન... સાલમુખારક...
આપનું આગામી ૨૦૧૪નું વર્ષ આપ સર્વે
માટે સુખમય... શાંતિમય... સંતોષમય
રહે તેવી શુભેચ્છા સાથે અભ્યર્થના.



'અચ્છે દિન આનેવાદે હે'ના સંકેત મળી રહ્યા છે.

લો, દિવાળી આવી પણ ગઈ! હજુ ૨૦૧૩ની દિવાળીના સ્મરણો વાગોળીએ છીએ ત્યાં તો ૨૦૧૪ની દિવાળી આવી પણ ગઈ. દિવસ ઊંઘ અને કચ્છારે ખતમ થઈ જાય એની ખબર ન પડે એવી જ રીતે વરસ કચ્છારે વીતી ગયું તે પણ ખબર પડી નહીં. આનું કારણ આપણી લાઈફસ્ટાઇલ ખૂબ જ ગડપી બની ગઈ છે.

ઉચ્ચ શિક્ષણ સહાય યોજના અંતર્ગત ૧૫ સાટેમ્બર, ૨૦૧૪થી નવા ફોર્મ લેવાનું બંધ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં ૬૮૧ વિદ્યાર્થીઓને લગભગ ઇપ્પિયા છ કરોડ જેટલી સહાય આપાઈ ચૂકી છે અને હજુ લગભગ '૨૨૫' જેટલા ફોર્મને સહાય આપવાની બાકી છે. ઢૂંક સમયમાં આ પ્રક્રિયા પૂરી કરવામાં આવશે. આપણે ત્યાં કોઈ પણ વિદ્યાર્થીને વ્યક્તિગત રીતે ઈન્ટરવ્યૂ લીધા વગર આપણે સહાય કરતા નથી અને ઈન્ટરવ્યૂ લેતી વખતે ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે વિદ્યાર્થી-વડીલોનું સંભાળ જળવાય. હજુ થોડાં ફંડની જરૂરિયાત છે, તો જે કોઈ સભ્યોએ પોતાના સેન્ટરમાં ફાળો લખાવ્યો ન હોય તેવો જરૂરથી લખાવે અને સેન્ટર દ્વારા પહોંચતો કરે. હું આપણા દરેક સભ્યોને વિનંતી કરું છું કે આ અભિયાનમાં ફાળો અચૂક લખાવે.

મુંબઈમાં સેન્ટ્રલ બોર્ડ દ્વારા બનાવેલું 'રિંગ પોઇન્ટ' નાટક સફળ ગયું. તેવી જ રીતે ગુજરાતમાં તે વાપી, ભાવનગર, અંકલેશ્વર તથા એલીસબિલ ખાતે અત્યંત સફળ રહ્યું અને સભ્યો ઉપરાંત ગામના શ્રેષ્ઠીઓએ પણ આમાં ખૂબ જ સારો સહકાર આપેલ. અમે તે દરેકનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. જે વિદ્યાર્થીઓનું ભાગાતર પૂરું થઈ ગયું છે તેઓનું ડોનેશનરૂપે ટિફન્ડ પણ વ્યવસ્થિત રીતે આવવાનું શરૂ થઈ રહ્યું છે.

વર્ષ ૨૦૧૪નું ઉચ્ચ શિક્ષણ અભિયાન લગભગ પૂર્ણ થવાને આવે છે, પણ એટલું ખરું કે કસોટી છતાં આ અભિયાન વ્યવસ્થિત રીતે ચાલી રહ્યું છે અને મુકામ પર પણ પહોંચી જાય છે તે માટે મારે દાતાઓનો તો આભાર માનવાનો છે જ, પણ જે.જે.સી. પરિવારના ૬૫,૦૦૦ સભ્યોનો પણ આ સાથે આભાર

માનું છું. ઉપરાંત ચાર મહિના બધું ભૂલી જઈને ખડે પગો કામ કરનાર આપણા સેન્ટ્રલ બોર્ડ તથા રોન્ટેબલ ટ્રસ્ટની કમિટીના સભ્યોને પણ સલામ કરું છું, જેઓના થકી આ અભિયાન પ્રજ્વલિત રહ્યું છે.

તાજેતરમાં શનિવાર, તા. ૨૦ સપ્ટેમ્બર, ૨૦૧૪ના રોજ ગુજરાત ખાતે ‘ધંધુકા’ સેન્ટરની સ્થાપના થઈ. આ સેન્ટરની સ્થાપના માટે મહેનત કરનાર બોટાડ સેન્ટરના કમિટી સભ્યોના અમે આભારી છીએ. સેન્ટરના ઉદ્ઘાટન સમયે સેન્ટ્રલ બોર્ડ તરફથી પદારેલા જિતુભાઈ કોઠારી, સંજ્ય શાહ, પ્રકુલ્પ કામદાર વગેરેએ સેન્ટર બાબત સંતોષ વ્યક્ત કર્યો હતો.

દેશ નવી સરકારના વડપણ હેઠળ સુરાગ પર ચાલતો જાય છે. અનેક ક્ષેત્રે કાંતિકારી પગાલાં આવી રહ્યાં છે. આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીજી દિવસના ૧૫ મિનિટ પણ આરામ કરતા નથી. તેમનો ઈરાદો સ્પષ્ટ છે. તેથી પરિણામ આવશે જ આવશે. કોઈ પણ પ્રકારની કદુ ભાષા વાપર્યા વિના તેઓ એક પછી એક મુદ્દા પર પ્રભુત્વ મેળવતા જાય છે.

વિદેશ ક્ષેત્રે પણ છેલ્લેછેલ્લે જાપાનને વશીકરણ કર્યા બાદ તેને ભારત આમંત્રિત કરી તેમણે પણ ભારત પત્યેના મોહપાશમાં ઝકડી લીધું તે એક અનેરી સિદ્ધિ છે. જોકે, ચીન પર કેટલો વિશ્વાસ મૂક્યો તે મોદીજી બરાબર જાણતા જ હશે અને ચીન પણ સમજુ ગયું હશે. આજનું ભારત એ કાંઈ ૧૯૬૨નું ભારત નથી અને મોદી એ કંઈ નહેરુ નથી. જે દિવસે ન્યૂગ્રેપેરમાં ચીનના વડા પ્રધાનનું સામૈયું કરવાના સમાચાર હતા, તેમની સાથે મોટામોટા કોન્ફ્રેક્ટના એગ્રીમેન્ટની વાત ચાલતી હતી તે જ દિવસે એ સમાચારની નીચે ચીનના લશકરે લદાખમાં ત્રણ કિ.મી. ધૂસણાખોરી કરવાના સમાચાર હતા. ચીન માટે આ રમત સાવ સામાન્ય છે, પણ ભારત હવે તેમાં છેતરાચ એમ નથી. જેવા સાથે તેવા થતા મોદીજુને સરસ જ આવડે છે એટલે આપણે સલામત છીએ. અત્યાર સુધી રાજકીય રીતે કાયમ માટે આપણાને ચિત કરનાર ‘પાકિસ્તાન’ને હવે આપણે બરાબરનો સબક શીખવાયો છે. દેશમાં જો એક સબળ નેતા હોય તો તેનાથી બધા જ ડરે તેવું ઇન્ડિયા ગાંધી પછી વાર પુરવાર થઈ રહ્યું છે.

મોદીજુએ આવતાંવેંત જ ચારાક્યબુદ્ધિના ચમકારા દેખાડ્યા છે. પડોશી ભૂતાન અને નેપાળને વશ કરી તરત

જાપાન ગયા. ત્યાં ઘણાબધા કોન્ફ્રેક્ટ કર્યા અને ચીનની આંખો ચાર થઈ. ચીનના વડા પ્રધાનને ભારત બોલાવી ઘણું સન્માન આપ્યું અને અમેરિકાના પેટમાં તેલ રેડાયું. છેલ્લે અમેરિકા ગયા. ભારતના કોઈ પણ વડા પ્રધાનને અમેરિકામાં આટલું સન્માન મળ્યું નથી. ન્યૂ યોર્કના ખૂબ જ પ્રસિદ્ધ મેડિસિન સ્ક્વેર ખાતે જાહેર સભા યોજી NRIને ચક્કિત કરી દીધા. પાસપોર્ટ અને વીજા બાબત ઘણી આશ્ર્યજનક જાહેરાત કરી NRIને ખુશ કરી દીધા. તે દિવસે ન્યૂ યોર્ક ખાતે થયેતા ઘસારાને પહોંચી વળવા અમેરિકન સરકારે સ્પેશિયલ ટ્રેન દોડાવવી પડી. ૨૦,૦૦૦ પાસ વહેંચાઈ ગયા પછી બીજા એટલા જ લોકો હોલની બહાર LED પર મોદીજુના ભાષણને માણાતા રહ્યા તથા તેમણે હિંદુસ્તાન, પાકિસ્તાનની સામાન્ય સમસ્યાનો ઉલ્લેખ ન કરીને મોટાઈ સિદ્ધ કરી. આપણાને ખરેખર આવા વડા પ્રધાન મળ્યા બદલ આનંદ છે. આપણે હવે કહી શક્યું કે ૨૧મી સદી હિંદુસ્તાનની છે.

‘MAKE IN INDIA’ના કથનને પ્રવેગ આપવા સરકાર કટીબદ્ધ થઈ રહી છે ત્યારે આપણા જૈન એન્ટરપ્રિન્સરો (Entrepreneur)એ સતર્ક થઈ આનો લાભ લેવા તૈયાર રહેવું જોઈએ. આપણાં સંતાનોને કહો કે તેઓ આપણા રક્તસંસ્કારો પ્રમાણે નોકરીની વાત છોડીને મેન્યુફેક્ચરિંગ/બિઝનેસ કરવા તૈયાર થઈ જાય. નોકરી કરવાથી ફક્ત આપણું જ ભલું થશે, જ્યારે બિઝનેસ કરવાથી આપણા આખા સમાજનું ભલું થશે તે ન ભૂલું જોઈએ. આવેલી દરેક તકને ઝડપી લેવી એ આપણા જુન્સ (Jeans)માં છે. છેલ્લા કેટલાક સમયથી ભણીગણીને નોકરી કરવાનું માનસ Develop થતું હતું તેના પર હવે બેક લગાવવાનો સમય આવી ગયો છે. દીર્ઘદિન, અનુભવ, બુદ્ધિચાતુર્ય, કૌશલ્ય, વારસાગત ડાયપણ, શિક્ષણ ભળેલું છે તેથી આપણે જરૂરી બિઝનેસ શ્રેત્રે ચમલકાર કરી શક્યું. આપણાં સંતાનોને કહો કે તેઓ બિઝનેસ માટે જ નિર્માણ થયેલાં છે. જગતમાં યહુદી પછી બીજા નંબરે જૈન લોકો જ બિઝનેસ માઈન્ડ ધરાવે છે તે સાબિત થઈ ગયેલી હકીકત છે. નહિંતર ૦.૫ ટકા વસતિ ધરાવતો સમાજ ૫૦% ઉપરાંત બિઝનેસ પર કાબૂ કર્ય રીતે ધરાવે? તે કેવી રીતે શક્ય બને? એમ કહેવાય છે ને કે ચંદ્ર પર પ્રથમ પગ મૂકુનાર અમેરિકન હતો, પણ પ્રથમ ઈન્ડસ્ટ્રી શર કરનાર ‘ગુજરાતી જૈન’ જ હશે.

બકરી 'ઈં' મુસ્લિમ બિરાદરોનો ધાર્મિક તહેવાર છે જેમાં અબોલ, નિર્દોષ, કોઈ પણ પ્રકારના વાંકગુના વિનાનાં નિરૂપદ્રવી, ખ્યોર વેજિટેરિયન પશુ-બકરા હજારોની સંખ્યામાં હલાલ થશે. આપણાથી તો અરેરાઠી બોલાઈ જાય એવી વાત છે. આપણે કોઈના ધર્મમાં દખલ કરતા નથી, પણ આ જુલમ સાંખી નહીં શકવાથી તેને આપણે આપણી રીતે સ્વરૂપ આપવાથી હજારોની સંખ્યામાં હલાલ થતા બકરાઓના શ્રેયાર્થે ઠેરઠેર જાપ, સ્તવન થશે. મેં નીરખ્યું છે કે આજે કોઈ પણ જૈન ઘર પછી તે સ્થાનકવાસી હોય, દેરાવાસી હોય, તેરાપંથી હોય કે દિંગંબર હોય, નિર્દોષ આત્માઓના શ્રેયાર્થે તપસ્યા વિનાનું બાકી નહીં હોય. કમસે કમ ઉપવાસ કે આચંબિલ તો લગભગ દરેક ઘરમાંથી થયેલા છે. આ આપણા ધર્મની વિશેષતા છે, મહાનતા છે. આપણાને એનું ગૌરવ છે કે નાનાં બાળકો પણ આવા અભિયાનમાં જોડાય છે. મુસ્લિમ બિરાદરોને એમનો ધર્મ મુખારક, આપણે આપણો ધર્મ નિભાવીએ.

લિ. રમેશ મોરણિયા

યોરમેન: જે.જે.સી. - સેન્ટ્રલ બોર્ડ

૨૦મ્મો સમૂહલગોચસ્વ

જૈન જાગૃતિ સેન્ટર-સેન્ટ્રલ બોર્ડ તથા
જૈન જાગૃતિ સેન્ટર-સેન્ટ્રલ બોર્ડ ચેરિટેબલ ટ્રસ્ટ
નું આયોજન

દિનાંક : રવિવાર, તા. ૨૮-૧૨-૨૦૧૪

સ્થળ : જે.વી.પી.ડી. ગ્રાઉન્ડ,
પી.વી.આર અને ચંદન ટોકીગંની પાસે, જુહુ

- : સહયોગી :-

પ્રેરક : માતુશ્રી તારાબહેન હિંમતલાલ શાહ
દુ. હિના દિપક શાહ (હિના ગ્રુપ ઓફ ક્રુ.)

ભોજન : શ્રી હિંમતલાલ નથુભાઈ શાહ
દુ. હિના ગ્રુપ ઓફ ક્રુ.

સજાવટ : હિના ગ્રુપ ઓફ ક્રુ. (હિના બિલ્ડર્સ)
દુ. મિહીર દિપકભાઈ શાહ તથા
પાયલ દિપકભાઈ શાહ

મુખ્ય આધારસ્તંભ : જેજેસી-નોર્થ ઈસ્ટ



જૈજેશી કાંદિવલી


સંચાલિત

જૈન સગાપણ માહિતિ સેન્ટર (કાંદિવલી)

(શ્રી કિરીટભાઈ ભાઈલાલભાઈ શાહ પરિવાર પ્રેરિત)

૭ઠો યુવક - યુવતી પરિચય સંમેલન (ગ્રેજ્યુઅએટ યુવા મેળો)

સોમવાર • તા. ૨૬ મી જાન્યુઆરી ૨૦૧૫ • સમય : સવારે ૮.૦૦ થી બપોર ૨.૦૦ સુધી



બે અલગ પરિવારોની પરંપરા, બે અલગ અલગ પાત્રોની વર્તમાન જીવનશૈલીની વિવિધતાનો સમજણાથી સમન્વય કરીને આપના ભાવિ જીવનને સગાપણાના સેતુ પ્રતિ દોરી જતો "મંગલ મંચ" એટલેજ "જૈન સગાપણ માહિતિ સેન્ટર" જેના દ્વારા રજીસ્ટર્ડ થયેલા, મુંબઈ કે મુંબઈ બહારના માત્ર અપરિણીત સ્નાતક (ગ્રેજ્યુઅએટ) થયેલા, જેઓની વય ર૧ થી ૩૧ વર્ષ સુધીની જ હોય એવા જૈન સમાજના લગ્ન ઈચ્છુક યુવક/યુવતીઓને તા. ૦૫.૧.૨૦૧૫ સુધીમાં તેમનું નામ રજીસ્ટર્ડ કરાવીને આ સંમેલનમાં સહભાગી થવા અમારું હાર્દિક આમંત્રણ છે. વહેલા તે પહેલાના ધોરણે નામો રજીસ્ટર્ડ કરવાના રહેશે. નિર્ધારીત સભ્ય સંખ્યા પૂરી થયા પછી વધુ નામો સ્વીકારવામાં આવશે નહીં.

સંપર્ક સૂચના : જૈન સગાપણ માહિતિ સેન્ટર

દુકાન નં. ૬, સાંઈરાજ ગાર્ડન, હેમુકલાની રોડ નં. ૩, (ઇરાની વાડી) મોદી પાર્કની સામે,
કાંદિવલી (વેસ્ટ) મુંબઈ - ૪૦૦ ૦૬૭. ફોન : ૨૮૬૬૦૧૬૬ / ૨૮૬૬૭૮૭૪૩૮ / ૨૮૨૧૦૫૦૧૬૮
Email : jjckvi22jainsagpan@gmail.com

મનોરંજનની અટારીએથી

જ.જ.સી.	તારીખ	કાર્યક્રમ
● અમૃતનગર	: ૨૦-૦૮-૧૪ નાટક : 'ગુજરૂભાઈ બન્યા દબંગ'	★
	૨૫-૦૮-૧૪થી ૦૩-૧૦-૧૪ 'VERSATIL NAVRATRI'	✉
● બોરીવલી	: ૧૭-૦૮-૧૪ હસાયરો : 'હાસ્ય દરબાર - સાઈરામ દવે'	✉
● ચેંબુર	: ૨૨-૦૮-૧૪ નાટક : 'થોડું લોજિક થોડું મેજિક'	★
● દાદર	: ૨૨-૦૮-૧૪ નાટક : 'પલ્ની સિંઘમ પતિ રિંગામ'	✉
● એલીસબિઝ	: ૧૧-૦૮-૧૪ મૂવી : 'મેરી કોમ'	▲
	૧૪-૦૮-૧૪ મૂવી : 'બે યાર'	▲
	૧૬-૦૮-૧૪ નાટક : 'ટર્નિંગ પોઇન્ટ'	✉
● ઘાટકોપર	: ૧૬-૦૮-૧૪ નાટક : 'કેરિઓન કરસન'	✉
● ગોલ્ડન ગારોડિયા	: ૧૮-૦૮-૧૪ રંગારંગ : 'ઈંજા ગોસર વ્યાસ અંડ પાર્ટી'	★
● જુહુ	: ૧૪-૦૮-૧૪ આર્કેસ્ટ્રા : 'દિલ ને ફિર યાદ કિયા'	✉
	૧૫-૦૮-૧૪ નાટક : 'થોડું લોજિક થોડું મેજિક'	✉
	૧૮-૦૮-૧૪ રંગારંગ : 'કાઢિયાવાડ ઓરલાઈન્સ'	✉
	૨૩-૦૮-૧૪ નાટક : 'કેરિઓન કરસન'	▲
	૨૬-૦૮-૧૪ રંગારંગ : 'નવરાત્રિ જલશો'	✉
● જુહુ બીચ	: ૧૮-૦૮-૧૪ — 'Mr. B Indian Super Brain'	★
	૨૪-૦૮-૧૪ રાસ : 'રાસગારબાની રમાર'	✉
● કલાનગરી વડોદરા	: ૧૭-૦૮-૧૪ નાટક : 'થોડું લોજિક થોડું મેજિક'	✉
● કણાવટી	: ૦૮-૦૮-૧૪ રંગારંગ : 'નયાનને બંધ રાખીને'	✉
● કાંદિવલી	: ૧૬-૦૮-૧૪ રંગારંગ : 'કાઢિયાવાડ ઓરલાઈન્સ'	★
● મુલુંડ	: ૨૨-૦૮-૧૪ — 'Mr. B Indian Super Brain'	✉
	૧૧-૦૮-૧૪ નાટક : 'થોડું લોજિક થોડું મેજિક'	✉
● મલાડ	: ૨૨-૦૮-૧૪ નાટક : 'જય શ્રીકૃષ્ણ ડાર્લિંગ'	✉
	૨૪-૦૮-૧૪ નાટક : 'થોડું લોજિક થોડું મેજિક'	✉
● નવી મુંબઈ	: ૨૪-૦૮-૧૪ નાટક : 'થોડું લોજિક થોડું મેજિક'	✉
● શિવાજી પાર્ક	: ૧૮-૦૮-૧૪ નાટક : 'જય શ્રીકૃષ્ણ ડાર્લિંગ'	★
● સુરેન્દ્રનગર	: ૧૬-૦૮-૧૪ & ૧૭-૦૮-૧૪ 'નવરાત્રિ મહોત્સવ'	✉
● ઉપલેટા	: ૧૪-૦૮-૧૪ રાસગારબા : 'સમૂહ ખમત ખામણા સંગ ડીનર પાર્ટી'	★
● વિલે પાર્લે	: ૧૮-૦૮-૧૪ રંગારંગ : 'દીવાનગી - કવ્યાલી'	✉
	૨૧-૦૮-૧૪ મૂવી : 'બે યાર'	✉
	૨૫-૦૮-૧૪ નાટક : 'જય શ્રીકૃષ્ણ ડાર્લિંગ'	✉
	૨૫-૦૮-૧૪થી ૦૩-૧૦-૧૪ રાસગારબા : 'નવરાત્રિ જલશો'	✉

સંઝા : કાર્યક્રમ - જમણ સાથે ★ જમણ વિના (ફ્રાય) ✉ સ્નેક્સ ▲

આગામી પ્રવાસ-પર્ચટન-પિકનિક-ધર્મયાત્રા

જે.જે.સી.	પ્રવાસ સ્થળ	દિનાંક
વિલે પાર્લે	નાની-મોટી પંચતીર્થી તથા ઐતિહાસિક કષ્ણ દર્શન	૨૮-૧૧-૨૦૧૪ થી ૦૫-૧૨-૨૦૧૪

પ્રવાસ-પિકનિક-ધર્મયાત્રા સંપદ્ધ

જે.જે.સી.	પ્રવાસ સ્થળ	દિનાંક
જૂનાગઢ	‘આરાધના ધામ તેમ જ સાંજના રિલાયન્સ મોલની સુનાઈ સફર’	૨૧-૦૮-૨૦૧૪
શિવાજી પાર્ક	‘નાગેશ્વર તીર્થ’	૨૦-૮-૨૦૧૪

પરસ્પર પ્રેમ અને પરિચયથી પાંગરતા પરિવાર સાથે ૧૫૮મા સેન્ટરનું જોડાણ થયું જેનું નામ છે ‘જૈન જાગૃતિ સેન્ટર-ધંધુકા’.

તા. ૨૦-૮-૨૦૧૪ ને શનિવારનો દિવસ ઉદ્ઘાટનનો મંગાણ દિવસ બન્યો. ગોરજ સમયે સાંજના ૬.૦૦ કલાકે જેજેસી-સેન્ટ્રલ બોર્ડના પદાધિકારીઓ સુસજ્જ થઈ અમદાવાદથી ધંધુકા પદ્ધાર્યા. ખોડિયાર માતાજીના મંદિર પાસેથી ટોલ અને શરણાઈના સૂરે અને સંગાથે સતવારા ઝાતિની વાડીએ સૌ પદ્ધાર્યા. સાફામાં સજ્જ મહેમાનોનું નાની બાળાઓએ ફુમુકુમ તિલક કરી ભાવબર્યું સ્વાગત કર્યું. બરાબર ૬.૩૦ કલાકે કાર્યક્રમનો શુભાર્થ થયો. સ્વાગત અને આવકાર પ્રવચન સેન્ટરના યુવાન પ્રમુખ શ્રી નિલેશભાઈ બગાડિયાએ કર્યું. દીપ પ્રાગાટ્ય સેન્ટ્રલ બોર્ડના પદાધિકારીઓ, સ્થાનિક ધારાસભ્ય તથા મહાનુભાવોએ કર્યું. આજના કાર્યક્રમના પ્રમુખસ્થાને શ્રી સંજયભાઈ શાહ હતા. મહેમાનોનું નું પુષ્પગુરુષ આપી અભિવાદન કરવામાં આવ્યું.

ચાર્ટર વાંચન જેજેસી જનરલ સેકેટરી શ્રી પ્રકુલ્લભાઈ કામદારે કર્યું. ચાર્ટર એનાયત શ્રી સંજયભાઈ શાહ તથા શ્રી જિતેન્દ્રભાઈ કોઠારીએ તાણીઓનાં ગડગડાટ સાથે કર્યું અને કારોબારી સભ્યોની શપથગ્રહણાવિધિ કરવામાં આવી.

આ સેન્ટર શરી કરવામાં જેજેસી-બોટાદે કરેલી મહેનત સફળ થઈ. એક વરસ પહેલાં સેન્ટ્રલ બોર્ડના પદાધિકારીઓ બોટાદ સેન્ટરની મુલાકાતે આવેલા ત્વારે મુ. શ્રી રમેશભાઈ મોરબિયાએ એક નવું સેન્ટર આપવા કરેલ માગાણીને આ રીતે બોટાદ સેન્ટરે પૂરી કરી.

આ પ્રસંગે જેજેસી-સેન્ટ્રલ બોર્ડના જનરલ સેકેટરી શ્રી પ્રકુલ્લભાઈ કામદારે જૈન જાગૃતિ સેન્ટરની પ્રવૃત્તિઓની જાંખી કરાવી. આઈ.પી.પી. શ્રી જિતેન્દ્રભાઈ કોઠારીએ હાયર એઝ્યુકેશન અંગેની પ્રવૃત્તિની વિગતે છણાવટ કરી.

જેજેસીમાં નવું પુષ્પ ખીલ્યું

પ્રમુખસ્થાનેથી શ્રી સંજયભાઈ શાહે આએ આ સેન્ટર થયાનો આનંદ વ્યક્ત કરી

વધુમાં વધુ સમાજનાં અને પરિવારનાં કામો કરી સેન્ટરને જગ્યાળતું કરે તેવી શુભેચ્છા સાથે ૧૭૮પથી શરી થયેલ જૈન જાગૃતિ સેન્ટરની માહિતી આપી. આ ઉપરાંત પ્રસંગોપાત્ર પ્રવચન આ વિસ્તારના માઝુ ધારાસભ્ય શ્રી લાલજીભાઈ મેર અને ગુજરાત માધ્યમિક સંઘના પ્રમુખશ્રી અને શિક્ષણાવિદ્ શ્રી નારણભાઈ ચાવડાએ આપ્યું. ધંધુકા નગરસેવા સદનના પ્રમુખ શ્રી હર્ષદભાઈ ચાવડાએ શુભેચ્છા વ્યક્ત કરી.

બોટાદ સેન્ટરના કો-ઓર્ડિનેટર શ્રી વિનુભાઈ બગાડિયાએ આ ધંધુકા સેન્ટર શરી કરવાથી આજના ઉદ્ઘાટન સુધીની તવારીખ આપી. કલિકાલ સર્વકા શ્રી હેમયંડ્રાચાર્યની જન્મભૂમિ પર શરી થતું આ સેન્ટર જૈન શાસનનો ડંકો વગાડી આચાર્ય શ્રી હેમયંડ્રાચાર્યનું નામ રોશન કરાવશે.

ધંધુકા સેન્ટરના શ્રી નિલેશભાઈ બગાડિયા તથા શ્રી પ્રમોદભાઈની આગેવાની હેઠળ સેન્ટરના કારોબારી સભ્યો અને કાર્યકરોએ ઉત્સાહ અને થનગાનાટ દાખવી આ ઉદ્ઘાટન પ્રસંગને ચાર ચાંદ લગાડ્યા. સમસ્ત જૈન સમાજનું સ્વામીવાત્સલ્ય રાખી છે. માણસોની હાજરીમાં આ સમાર્દંબ રંગોંગો ઊજવાયો.

બોટાદ સેન્ટરના સભ્યો શ્રી સંજયભાઈ દોશી (પ્રમુખ), શ્રી હિતેશભાઈ શાહ (I.P.P.), શ્રી રાજા કોઠારી (ઉપપ્રમુખ), શ્રી કમલેશ ચીકાણી (સેકેટરી), શ્રી પારસ ડગાતી (ખજાનચી), શ્રી વિમલ ગાંધી, શ્રી સમીર દોશી, શ્રી વિજય બારલાયા, શ્રી હિતેશ દેસાઈ, શ્રી નિલેશ બગાડિયા વગેરેએ હાજર રહી શોભામાં અભિવૃદ્ધિ કરી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન બોટાદ સેન્ટરના ઉપપ્રમુખ શ્રી રાજા કોઠારીએ કર્યું.

આ સેન્ટર શરી થતાં ૧૩૫ સભ્યો નોંધાઈ ગયેલ છે.

- રિપોર્ટ બાય જેજેસી-બોટાદ

જેજેસીની આજકાલ

તપસ્વી બહુમાન

જેજેસી-લેડીગ વિંગ અમદાવાદ

બુધવાર, તા. ૧૭-૮-૨૦૧૪ના દિવસે તપસ્વીના બહુમાનનો કાર્યક્રમ રાખવામાં આવેલ. આ વર્ષ સેન્ટરમાંથી કુલ ૧૮ સભ્યોએ આઠ તથા તેથી વધારે ઉપવાસની આરાધના કરેલ જેમાંથી પાંચ સભ્યોએ તો માસખમણા'ની ઉગ્ર આરાધના કરેલ. તેઓના નામ નીચે પ્રમાણે છે.



અવનિબહેન
ભરત કોઠારી



રીતાબહેન
જીવલિત શાહ



મુદુલાબહેન
લીનેશા શાહ



જયશ્રીબહેન
અન. શાહ



નિરંજનાબહેન
સી. વોરા

ઉપરોક્ત દરેક તપસ્વીઓને અભિનંદન. તપસ્વીના બહુમાનના કાર્યક્રમના અંતે હાઉસિનો કાર્યક્રમ વણી લીધેલ જેમાં બહેનોએ ખૂબ જ આનંદ માણ્યો.

જેજેસી - ઉપલેટા

સેન્ટર વર્ષ ૨૦૧૪માં પોતાના દશાઢી વર્ષમાં ખૂબ જ આકર્ષિત બની ગયેલ છે.

આગામી કાર્યક્રમને એટલે કે નવરાત્રિની રદ્દિયાળી રાતમાં બંને સમાજને લક્ષ્ય દર વર્ષ રાસોત્સવનું આયોજન કરે જ છે, પરંતુ આ વર્ષ બધા જ મેમ્બર્સ નોરતામાં રાસ-ગરબા વગેરે સંપૂર્ણ રીતે રમી શકે, ખેલૈયાઓ ધૂમ મચાવી શકે તેવા લાગણીશીલ હેતુથી એક એવું આયોજન જે કોઈ સેન્ટર કે સંસ્થા દ્વારા જોવા મળતું નથી તેવું

ભાવવિભોર આયોજન એટલે કે નવરાત્રિ રાસ-ગરબા-શિખિતનું આયોજન કરેલ.

દસ દિવસના આ પ્રોગ્રામમાં ફક્ત કપલના ૧૫૦/- રૂપિયા ટોકન ચાર્જ રાખી બાળકો સાથે રાસ-ગરબા શીખવાનું આયોજન કરેલ, જેમાં લગભગ ૩૦ કપલ જોડાયેલ, બાળકોએ પણ ફોર સ્ટેપ, સિક્સ સ્ટેપ, પનઘટ, ટીટોડો વગેરે જેવા રાસની સંપૂર્ણ તાલીમ લીધી.

સેન્ટરે આ શિખિતમાં ખૂબ જ સફળતા પ્રાપ્ત કરેલ છે.

પ્રમુખશ્રી તથા સેકેટરીએ જણાવેલ કે આપણા સેન્ટરના આ આયોજનથી અન્ય સેન્ટરો પણ જરૂર આવા આયોજન ગોઠવશે.

કહેવાય છે કે,

કૂલો કી ખુશ્યુ સિર્કિઝ હવા કી દિશા મેં ફેલતી હૈ,
લેકીન હમારે સેન્ટર કી અચ્છાઈયા હર દિશા મેં ફેલેંગી.
Because of 'JAGRUTI SANDESH'.

તપસ્વી બહુમાન

જેજેસી-એલીસબ્રિજ

રવિવાર, તા. ૧૮-૧૦-૨૦૧૪ના રોજ યોજાયેલ કાર્યક્રમમાં આ વર્ષ જે સભ્યોએ આઠ તથા તેથી વધુ ઉપવાસ કર્યા હોય તેવા ૪૫ સભ્યોનું બહુમાન કરવામાં આવેલ, જે પૈકી નીચે જણાવેલ 'જ' સભ્યોએ તો માસખમણા'ની ઉગ્ર આરાધના કરેલ.



ચંદ્રબહેન
પંકજ શાહ



અશ્વિનાબહેન
નીતિન દલાલ



જયશ્રીબહેન
વીરેન્દ્ર શાહ



દિપિકાબહેન
શિલ્પા શાહ



મૃગેશબાઈ
જિતવંતલાલ શાહ



જયેશબાઈ
મચાબાઈ શાહ

પરિયય મેળો

જેજેસી - અંકલેશ્વર

હાલના ચુગમાં સમાજમાં જો કોઈ વિકટ સમસ્યા હોય તો તે છે દીકરા-દીકરીનાં સગપણાની. અગાઉના સમયમાં આપણા વડીલો દ્વારા જ આ સમસ્યાનો ઉકેલ મળી જતો હતો, પરંતુ હાલના સમયમાં દરેક વડીલો આ સામાજિક વ્યવસ્થાથી વિમુખ થઈ રહ્યા છે. તેનું કારણ આપણા સમાજના લોકોનો દેશ-વિદેશમાં વસવાટ થઈ રહ્યો છે અને એકબીજાના સંપર્ક ઘટી રહ્યા છે, જેથી આ આધુનિક ચુગમાં સમાજમાં સગપણાની સમસ્યાના ઉકેલ માટે જેન જાગૃતિ સેન્ટર-અંકલેશ્વરના પ્રમુખ શ્રી વિનોદ ધોકા તથા તેમની ટીમ દ્વારા છેલ્લાં પાંચ વર્ષથી સમસ્ત જૈન અપરિણીત



ચુવક-ચુવતી પરિયય મેળાનું સફળતાપૂર્વક આયોજન કરી રહ્યું છે અને છેલ્લાં પાંચ વર્ષમાં મેળામાં ભાગ લેનાર ૭૦% ચુવાધન પરિયયથી પરિણાય તરફ પ્રયાણ કરી રહ્યું છે. તેથી પ્રેરાઈને સેન્ટર દ્વારા છહ્યો પરિયય મેળો રવિવાર, તા. ૫-૧૦-૨૦૧૪ના રોજ ચોલાયો હતો.

સદર પરિયય મેળામાં મુંબદ્ધથી જેજેસી-સેન્ટ્રલ બોર્ડના ચેરમેન શ્રી રમેશભાઈ મોરબિયા હાજર રહ્યા હતા.

રમેશભાઈ મોરબિયાએ ચુવાધનને આશીર્વાદ આપી જણાવેલ કે આ અંકલેશ્વર એક જ સેન્ટર એવું છે જ્યાં વર્ષમાં બે-ત્રણ વખત આવવાનું થાય જ છે. અંકલેશ્વર સેન્ટરનાં સેવાકીય કાર્યોની પ્રશંસા કરી આશીર્વાદ પાઠ્યા. કાર્યક્રમમાં ૫૧૫ એન્ટ્રીઓ આવી હતી.

કાર્યક્રમ બાદ ઉમેદવારોના ઈન્ફ્રાઓક્શન પછી ચુવક-ચુવતીઓની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. સદર આયોજનમાં આવેલ ઉમેદવારો પસંદગીનાં પાત્રો સાથે મિટિંગ કરી પસંદગીથી પરિણાય તરફ આગળ વધ્યા હતા.

મુખ્ય

યાન બનાવી મંગળ પર સફળતાપૂર્વક મોકલનાર ભારત દેશો પોતાની જરૂરિયાત માટેના પેન્સિલ, રબર, દિવાળી માટેના ફટાકડા, શૂઝ, રેડિમેડ કપડાં, બોલપેન જેવી નાચીજ વસ્તુઓ કંટેનરો ભરીને ચાયનાથી મગાવી પડે તેના જેવી બીજી કમનસીબી કઈ કહેવાચ. મોદી સરકારે આવતાંવેંત જ સ્લોગન આપ્યું 'મેક ઇન ઇન્ડિયા'. આપણી જરૂર પૂર્તી દરેકેદરેક વસ્તુ ભારતમાં જ બને. ભારતનો ચુવાન ટેલોન્ટેડ છે. ભારત પાસો 'Infrastructure'ની થોડી કમી છે, પણ તે દૂર કરવાનું કાર્ય સરકારે પ્રાયોરિટી પર લીધું છે.

૬૭ વર્ષ પહેલાં હિન્ડુસ્તાન સ્વતંત્ર થયું ત્યારે 'Development' માટે પુષ્કળ અવકાશ હતો, પણ ત્યારે દુનિયા બે લોબીમાં વિભાજિત થયેલી હતી. 'રાઈટીસ' અને 'લેફ્ટીસ'. તત્ત્વ રહેવાના ધ્યારામાં ભારત કોઈ ફિક્સ પોલિસી કરી શક્યું નહીં અને 'શિયાળ તાણે સીમ ભણી અને કૂતરું તાણે ગામ ભણી, પછી રહે ઢેર ના ઢેર.' એવી રીતે ભારતની પ્રગતિ કુંઠિત થઈ ગઈ અમાં બગડેલી બ્યૂરોક્સીએ દાટ વાળી નાખ્યો. એક મંજૂરી લેવા માટે ૧૨-૧૫ ફોર્મ ભરવાં પડે અને દરેક ફોર્મમાં આઠઆઠ-દસદસ પાનાં હોય અને અલગ અલગ ડિપાર્ટમેન્ટ પાસે જવું પડે. આ બધું બ્યૂરોક્સી પર ઉપાર્જિત હતું. 'Install' અને 'Permissible' કેપેસિટી કરતા જો કોઈ વધુ પ્રોડક્શન કાઢે તો તે સજાને પાત્ર ગણાતું. આ વસ્તુ 'ગુરુ' નામના પિકચરમાં સ્પષ્ટ બતાવ્યું છે. 'ગુરુ' (ધીરુભાઈ)એ 'Install Machinery' દ્વારા વધારે પ્રોડક્શન આપ્યું તો તેમને આરોપીના પાંજરામાં ઊભા કરી દેવાયા. સરકારની આવી નીતિ હોવા છતાં ભારતમાં પ્રોઇવટ ક્લેન્ન ઘણી પ્રગતિ કરી છે તે ભુલાય એમ નથી. ચાયનાએ ઈન્ડસ્ટ્રીયલ પોલિસીમાં ધરખમ બદલાવ કરી મેન્યુફેક્ચરિંગ એક્ઝિટિવિટીને ખૂબ જ પ્રોત્સાહન આપ્યું, જેથી તે અત્યારે દુનિયામાં છવાઈ ગયું છે. ભારતે હિંમત કરીને બ્યૂરોક્સીને કંટ્રોલમાં લઈ વ્યાપાર-ધંધાને ખૂબ જ મહત્વ આપવું પડશે. તો આપણી પ્રગતિ નક્કી છે જ. ભારત સરકારે 'મેક ઇન ઇન્ડિયા'ના કોન્સોપ્ટને Emblem આપી નવાજિત કરેલ છે જે કવર પેજ પર દર્શાવેલ છે.

જય હો! જય હિન્દ!

આગળ આપણે શાવક
વિશે તથા શાવકનાં બાર પ્રત
પૈકી પાંચ અણુગ્રત વિશે
વિસ્તારપૂર્વક જોઈ ગયા. આજે
આપણે બાકીનાં ગ્રણ ગુણ અને ચાર શિક્ષાગ્રત વિશે જોઈએ.

ગુણગ્રત એટલે જે પ્રત અણુગ્રતના ગુણોમાં વધારો
કરવાનાર છે. તે ગુણગ્રત ગુણોને વધારે ઉજાજળ બનાવે છે.
ગુણગ્રત ગ્રણ છે (૬) દિગ્ઘત અથવા દિશા પરિમાણગ્રત
(૭) ભોગોપભોગ અથવા ઉપભોગ પરિભોગ પરિમાણગ્રત
અને (૮) અનર્થદંડ વિરમણગ્રત.

(૬) દિશા પરિમાણગ્રત : આ પ્રત દિશાઓની મર્યાદા
કરવાનું છે. અહીં છ દિશા લેવાની છે. ચાર દિશા - ઉત્તર-
દક્ષિણ-પૂર્વ-પશ્ચિમ અને ઉપર તથા નીચે એમ છ દિશાની
મર્યાદા કરવાની છે. આમ તો ચાર દિશા, ચાર ખૂણા અને
ઉપર-નીચે એમ દર દિશાઓ કહેવાય છે, પણ અહીંથી દરે
દિશાનો સમાવેશ ગ્રણ શબ્દમાં થઈ જાય છે. ઉદ્ઘર્ય દિશા,
અધ્યો દિશા અને તિર્યુ અથવા તિરિય દિશા. આ તિર્યુ
દિશામાં ઉપર-નીચે સિવાયની બાકીની આઠ દિશાનો સમાવેશ
એક જ દિશામાં થઈ જાય છે.

અતિચાર : ઉદ્દૂદિશી પમાણાઈકક્કમે - ઉપરની દિશાની
મર્યાદા ઓળંગી હોય.

અધ્યો દિશા પમાણાઈકક્કમે - નીચેની દિશાની મર્યાદા
ઓળંગી હોય.

તિરિય દિશા. પમાણાઈકક્કમે - તિરછી દિશાની મર્યાદા
ઓળંગી હોય.

ખેતવૃદ્ધી - ક્ષેત્રવૃદ્ધિ - એક દિશાની મર્યાદા બીજી
દિશામાં વધારી દેવી અથવા બધી જ દિશાની મર્યાદા એક જ
દિશામાં વધારી દેવી.

સઈ અંતરખાએ - પ્રમાદ કે મોહવશ ભૂમિની મર્યાદા
રાખી છે તે ભુલાઈ જાય અને આગળ વધે અથવા તો કરેલી
મર્યાદામાં શંકા પડ્યા છતાં આગળ જવાયું હોય.

આ પ્રત કરવાથી લોક - જે અસંખ્ય કોડાકોડી યોજન
વિસ્તારવાળો છે જેમાં સતત પ્રવૃત્તિ અને કિયા થતી રહેતી
હોય છે. તેથી દિશાઓની મર્યાદા કરવાથી અથવા તો
મર્યાદાની બહાર જવાનો ત્યાગ કરવાથી તે જગ્યાએ થતી
હિંસા આદિ પાપોનો મોટો કર્મબંધ અટકી શકે છે અને
આશ્વને રોકી શકાય છે.

(૭) ભોગોપભોગ પરિમાણગ્રત - ઉપભોગ પરિભોગ

પરિમાણગ્રત : જે વસ્તુ એકવાર
ભોગવવામાં આવે તેને ભોગ
અથવા ઉપભોગ કહેવાય છે.
(ઉપભોગ) પરિભોગ

પરિમાણગ્રતના અર્થમાં જે વસ્તુ વાર્તવાર ભોગવવામાં આવે
છે તેને ઉપભોગ (ભોગોપભોગ પરિમાણગ્રતના અર્થમાં) અથવા
પરિભોગ (ઉપભોગ પરિભોગ પરિમાણગ્રતના અર્થમાં) કહેવાય
છે. અશ્વ, પાણી, ફળ આદિ વસ્તુ એકવાર જ ઉપયોગમાં
લઈ શકાય છે, જ્યારે વસ્ત્ર, પાત્ર, આભૂષણ વગેરે વસ્તુ
વાર્તવાર ઉપયોગમાં લઈ શકાય છે. તેથી આ પ્રત ભોગ-
ઉપભોગની વસ્તુની મર્યાદા કરવાનું સૂચયે છે. તે સાથે જ
વ્યાપાર પરિમાણ પણ સૂચયે છે. ભોગોપભોગમાં રેદ (છ્વીસ)
પ્રકારની વસ્તુની મર્યાદા કરવાની હોય છે. તેમાં દુવાલ-
નેર્કીન-દાતણ-ફળ-પાણી-વિલેપન-આભૂષણ, ખાવાની વસ્તુ
વગેરે ઉયોગમાં લેવાતી મોટા ભાગની વસ્તુઓનો સમાવેશ
થઈ જાય છે. વ્યાપારસંબંધી હ્યુપ (પંદર) કર્મદાનનો ત્યાગ
કરવાનું સૂચયે છે. જે ધંધા અને કાર્યોમાં વિશેષ હિંસા આદિ
કારણોથી કર્માનો વિશેષ બંધ થાય તેને કર્મદાન કહે છે.

અતિચાર :- સચિતાહારે - સચિત વસ્તુનો ત્યાગ હોવા
ઇતાં તેનો ઉપયોગ કર્યો હોય, સચિત પડિબદ્ધાહારે-સચિત
વસ્તુ સાથે મળેલ અચિતનો આહાર કર્યો હોય, અઘોલિયો
સહિ ભક્ખણાયા - અધૂરી પાકેલી વસ્તુનો આહાર કર્યો
હોય, દુષ્પોલિયો સહિ ભૂક્ખણાયા - અવિદ્યિથી પક્વેલ
વસ્તુનો આહાર કર્યો હોય, તુચ્છોસહિ ભક્ખણાયા - ખાવાનું
થોડું અને ફેંકવાનું વધુ હોય તેવી વસ્તુ વાપરી હોય જેવી કે
બોર, સીતાળન, શેરડી વગેરે.

આ પાંચ અતિચાર ભોજનસંબંધી છે અને આ જ પ્રતના
બીજા પંદર અતિચાર વ્યાપારસંબંધી છે. જેમાંથી હિંસાની
પ્રેરણા મળે અથવા કર્મના હેતુ હોવાથી એવા વ્યાપાર ન
કરવાનું સૂચયે છે.

આ પ્રતના પાલનથી ઈચ્છા ને આવશ્યકતા અથવા
જરૂરિયાતો દાટે છે. જુવન સંતોષી અને ત્યાગમય બને છે.
ધર્માચારણ માટે વધુ સમય મળે છે. મોટો કર્મબંધ અટકે
છે અને સંકટ-વિકટ્યથી મુક્તિ મળે છે. ભોગની લાલસા
ઓછી થાય છે અને અનુચિત ઉદ્ઘોગાદંધા પર નિયંત્રણ થઈ
શકે છે.

(૮) અનર્થ દંડ વિરમણગ્રત : અજાન અવસ્થામાં કારણ
વગારનાં અનેક પાપથી મન-વચન-કાચાની અશુભ પ્રવૃત્તિથી

આત્મા દંડાય છે. જે કાર્ય પોતાના પરિવારના કોઈ હિતનું ન હોય અથવા જેનું કોઈ પ્રયોજન ન હોય અને જેના કારણે વ્યર્થ હિંસા થવાથી આત્મા પાપોથી દંડિત થાય તેને અનર્થ દંડ કહેવાય છે. જેનાથી આત્મા તેમ જ અન્ય પ્રાપી દંડિત થાય એવી મન-વચન-કાયાની કલુષિત પ્રવૃત્તિને દંડ કહેવાય છે. આર્તદ્યાન-રૌદ્રદ્યાન, પાંચ પ્રકારના મદ (પ્રમાદ-નિદ્રા-વિકથા-વિષય-કષાય), હિંસા પ્રદાન અને પાપ કર્મોપદેશથી અનર્થ દંડ થાય છે.

અતિચાર : કદ્યે - કામવિકાર જાગે તેવી વાતો કરવાથી, વિકથા કે રાગના આવેશથી મજાક કરવી.

કુક્કાએ - બીજાને હસાવવા, હસીમજાક કરવા, કુચેષ્ટા કરવાથી.

મોહન્દિયે - મર્મભેદક વચન બોલવાથી, વધારેપડું કે ઉટપટાંગ બોલવાથી.

સંજુતાહિ મરેણ - હિંસાકારી અધિકરણો બનાવવાથી, હિંસક શાસ્ત્રો કે સાહિત્ય કોઈને આ ઉપભોગ પરિભોગ અધિસે ભોગપરિભોગનાં સાધનો ભેગાં કરવાથી, ભોગ માટે આસક્તિ રાખવાથી, આ ગ્રતના પાલનથી, પ્રયોજન વિનાના પાપથી નિવૃત્ત થઈ શકાય છે. ખોટું કરવાથી કે બીજાને નુકસાન કરવાના વિચારથી મુક્તિ મળે છે. હિંસાકારી પ્રવૃત્તિ કે કોઈને તે બાબતનાં સલાહ-સૂચન આપવાથી મુક્ત થઈ શકાય છે.

હવે પછીનાં ચાર ગ્રતો સંયમધર્મની તાલીમઝપ છે તેથી તેને શિક્ષાવત કહેવાય છે.

૬) સામાયિક ગ્રત : આત્માનું શુદ્ધ સ્વરૂપ સમતામય છે. રાગદ્રેષમાં સમભાવ રાખવો તે સામાયિકનું લક્ષ્યબિંદુ છે. સમભાવની સાધનારૂપ ૪૮ મિનિટની વિરતિનું નામ સામાયિક છે. સામાયિકમાં સાવધ યોગનો ત્યાગ કરવાનો હોય છે. અટાર પાપસ્થાનકને સાવધ યોગ કરે છે. સાવધ યોગ એટલે પાપકારી પ્રવૃત્તિ, સામાયિકમાં સાવધ યોગનો નિષેધ અને ધર્મકરણનું આચરણ કરવાનું હોય છે. બે ઘડી સુધી ધર્મદ્યાન તથા શુભચિંતનમાં મનને લગાડી સમભાવની સાધના કરવી તેનું નામ સામાયિક છે. સામાયિકમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ જેવી બાબતે ધ્યાન રાખવું જોઈએ. દ્રવ્યથી-પાપકારી પ્રવૃત્તિનો ત્યાગ ક્ષેત્ર-લોક પ્રમાણ છે. નિરવધ સ્થાન કાળ-૪૮ મિનિટ અથવા બે ઘડી ભાવ-વિચારોની શુદ્ધિ અને સમભાવમાં રહેવું. શ્રાવકનું સામાયિક બે કરણ અને ગ્રણ યોગથી હોય છે.

અતિચાર : મન દુષ્પણિહાણો - મનમાં ખરાબ વિચાર કરવા, દુષ્ટ ચિંતન કરવું.

વય દુષ્પણિહાણો - સાવધ વચન બોલવા, દુષ્ટ વચન બોલવા.

કાય દુષ્પણિહાણો - કાયાને માઠી રીતે પ્રવર્તાવવી. સાવધ પ્રવૃત્તિ કરવી.

સામાયિકસસ સઈ અકરાણયાએ - સામાયિક જેમ તેમ કરવું.

સામાયિકસસ અણ વિહિયસસ કરણયાએ - સામાયિક પૂરું થથા પહેલાં પારી લેવું, વહેલું પારવાથી અથવા પારવું. વીસરવું ચૂતિ ન રહેવી.

આ ગ્રત કરવાથી આવતાં નવાં કર્મો રોકાય છે તેથી આશ્રવ પળાય છે. જૂનાં કર્મોનો ક્ષય થાય છે. આત્મિક શાંતિ મળે છે. સુખ ને સમભાવની પ્રાપ્તિ થાય છે.

૧૦) દેશાવમાસિક ગ્રત : આત્માનો શુદ્ધ સ્વભાવ તે સંવર ધરમાં રહેવાનો છે. માટે આશ્રવનો સર્વથા ત્યાગ કરવાનો છે. પહેલાંનાં બધાં જ ગ્રતોની મર્યાદાઓ પ્રતિદિન માટે કરવી તે દેશાવમાસિક ગ્રત છે. વર્તમાનમાં આ ગ્રત સંક્ષેપથી ચૌદ નિયમો ધારણ કરી કરવાનાં હોય છે. સચેત-દ્રવ્ય-વિગાઈ-સ્નાન-પગારખાં-દિશા-શયન-બ્લયર્ચ-કુસુમ-વિલેપન-વાહન-વસ્ત્ર-ભોજન-મુખવાસ આ ચૌદ વસ્તુની મર્યાદા કરવી. છહા ગ્રતમાં દિશાની મર્યાદાના જાવજીવ પદ્ધ્યકખાણ કરાય છે, જ્યારે દશમા ગ્રતમાં એક દિવસ-રાત્રિ દિશા અને ભોગોપભોગની મર્યાદા કરવામાં આવે છે.

અતિચાર : આણવણ પઉંગો - મર્યાદા કરેલ ભૂમિની બહારની વસ્તુ મગાવી હોય.

પેસવણ પઉંગો - મર્યાદા બહાર બીજા દ્વારા વસ્તુ મગાવે કે મોકલે.

સહ્યાણુવાએ - મર્યાદા બહારની કે ધારેલી હંદની બહારની વસ્તુ શાબ્દ કરીને કે ખાંસી વગેરેનો અવાજ કરીને મગાવી હોય તો.

રવાણુવાએ - દિશારો કરીને હંદની બહારની વસ્તુ મગાવી હોય.

બહિયા પોગગત પકેખરે-મર્યાદા બહારની દિશામાં કાંકરો આદિ ફેંકીને કોઈને બોલાવી હોય.

આ ગ્રતના પાલનથી ભોગ-ઉપભોગની વસ્તુની મર્યાદા થઈ જાય છે. ત્યાગ કરવાથી આસક્તિ ઘટતી જાય છે અને મનને શાંતિ મળે છે.

૧૧) પૌષ્ઠ વ્રત : આત્માના ગુણોનું પૌષ્ઠણ કરે અને ધર્મને પુષ્ટ કરે તેને પૌષ્ઠ કહેવાય છે. એક દિવસ અને રાત (આઠ પ્રફર) વિરતિની સાધના તે પૌષ્ઠ. શ્રાવકે મહિનામાં છ પૌષ્ઠ કરવાના હોય છે. પૌષ્ઠ ચાર પ્રહરનો પણ કરી શકાય છે. વસ્ત્ર આદિ બધાં ઉપકરણોમાં કોઈ જીવ છે કે નહિ તેનું નિરીક્ષણ (જોવું) કરવું તે પ્રતિલેખન છે. જીવ આદિ દેખાય તો તેને જતના - છળવા હાથે પૂંજણી કે રજોહરણ વડે સુરક્ષિત સ્થાને મૂકવું તે પ્રમાર્જન છે.

અતિચાર : અઘડિ લેહિય દુઃ્ખડિ લેહિય સેજજા સંથાવાએ - ઉઠવા-બેસવા-સૂવાની ભૂમિ કે પથારીનું બરાબર પ્રતિલેખન કર્યું ન હોય.

અઘ મજિજય દુઃ્ખ મજિજય દુઃ્ખમજિજય સેજજા સંથારાએ - ઉઠવા-બેસવા-સૂવાની ભૂમિ, પથારી બરાબર પૂંજી ન હોય.

અઘડિ લિહિય દુઃ્ખડિ ઉચ્ચાર પાસવણ ભૂમિ - લઘુનીત વડીનીત પરદવાની ભૂમિનું બરાબર પ્રતિલેખન કર્યું ન હોય.

અઘ મજિજય દુઃ્ખમજિજય ઉચ્ચાર પાસવણ ભૂમિ - લઘુનીત વડીનીત પરદવાની ભૂમિ પૂંજી ન હોય અથવા પૂંજી હોય તો બરાબર ન પૂંજી હોય.

પોસહસ્સ સમં અણાણુ પાલયણ - પૌષ્ઠવ્રતને અવિધિએ આદર્યુ કે પાણ્યું હોય.

પૌષ્ઠવ્રત કરવાથી શ્રાવકને સાધુજીવનનો લાભ મળી શકે છે. સાધુ જેવા આચાર-વિચારનો અનુભવ પ્રાપ્ત થઈ શકે છે.

૧૨) અતિથિ સંવિભાગ વ્રત : જેના આવવાની તિથિ નક્કી નથી હોતી તે અતિથિ. અહીં અતિથિનો અર્થ સાધુ-સાધ્વી જાણવો. સંયમી જીવો ને જીવનનિર્વાહ યોગ્ય શુદ્ધ વસ્તુઓનું ભક્તિપૂર્વક દાન કરવું તેને અતિથિ સંવિભાગ વ્રત કે નિર્દોષ આહાર-પાણી-વસ્ત્ર-પાગ્રાદિ સુપાત્ર દાન આપી સંયમમાં સહાયક થઈ ગૃહસ્થના પોતાના ઉપયોગમાં લેવાતા હોય તેવા આહાર આદિ ચૌદ પ્રકારની વસ્તુઓ મહાવતધારી સાધુઓને ફક્ત આત્મકલ્યાણની ભાવનાથી વહોરાવવી તે અતિથિ સંવિભાગ.

અતિચાર : સચિત નિક્ખેવણિયા - અચિત વસ્તુ સચિત પર રાખી હોય.

સચિત પેહણિયા - અચિત વસ્તુ સચેત વસ્તુથી ટાંકી હોય.

કાલાઈક્કમે - સમય વીતી ગયા બાદ વહોરાવ્યું હોય.

પરોવાએસે - બીજાની વસ્તુ પોતાની જણાવી વહેરાવે. પોતે કરી શકતા હોય છતાં બીજા પાસે વહોરાવે.

મર્યાદિયાએ - દાન આપીને અભિમાન કર્યું હોય અથવા તો પશ્ચાતાપ કર્યો હોય.

આ વ્રતના પાલનથી દાન કરવાની, ત્યાગ તથા સંતોષની ભાવના વધે છે. ભાવપૂર્વક દાન કરવાથી ભવો ઓછા થાય છે. સંયમીને સહાયક થવાનો લાભ લેવાથી સુપાત્ર દાનનો અવસર પ્રાપ્ત થઈ શકે છે.

અને આપણે શ્રાવકનાં બાર વ્રત - તેના અતિચાર - તેનાથી થતા લાભ વિશે જોઈ ગયા. જેના વડે આપણે જાણી શકીએ છીએ કે આપણે શું કરવું અને શું ન કરવું? આટલું જાણીને આપણે કંઈક અંશે પણ તેને આચારમાં મૂકી શકીએ તો આ જાણ્યું સાર્થક થશે.

જત સાથે દોસ્તી કરો

■ લલિતકુમાર શાહ

પોતાની જત સાથે દોસ્તી કરનાર જ સાચી દોસ્તી કરી શકે છે. જત સાથેની દોસ્તી એને સ્વયંની નિર્ભયતાનો અહેસાસ કરાવશે, ખૂબીઓ જોશો, પણ ખામીઓ વિશે જગત બનશે. આવું છશો તો જ એને એનો મિત્ર કોઈ ગુણ કે અવગુણ બતાવે તો એ સારી રીતે સમજુ શકશે.

આપણી સુખની પળો સાચા મિત્રને પ્રસક્ષ્ણા આપે છે અને એવો મિત્ર આપણાં પ્રગાટ-અપ્રગાટ તમામ દુઃ્ખોનો ભાગીદાર બની રહે છે. વળી, મિત્રની સાથે સંદેશ મિત્ર સમાન વ્યવહાર કરવો, એના શિક્ષક કે માર્ગદર્શક થવાનું લેશ પણ વિચારશો નહિ. આમ કરશો તો એ મિત્રતા તૂટી જશે. વળી, નવા મિત્રો થતાં જૂના મિત્રોને સંદેશ સ્મરણમાં રાખવા. બાળપણાના ગોઠિયા પર આપણાને કેવો નૈસર્જિક ભાવ હોય છે.

નવા મિત્રો આકર્ષક છે, પણ ‘જૂનું તે સોનું’ એ ન્યાયે પુરાણા મિત્રોની મિત્રતા અતિમૂલ્યવાન છે. મૈત્રી અને ખુશામત વચ્ચે જમીન-આસમાનનું અંતર છે. મૈત્રી સામી વ્યક્તિના ગુણ અને દોષ બજે જુએ છે. મૈત્રી મિત્રના જીવનને ગ્રાજવાના પલ્લે તોળે છે, જ્યારે ખુશામતના ગ્રાજવાને બીજું પલ્લું હોતું નથી.

જ્ઞાનપંચમી-જ્ઞાનગા દીવડા પ્રગાટાવો

■ હરીશ મહેતા

કારતક સુદ પાંચમ અન્ય સમાજ લાભપાંચમ તરીકે ઊજવે છે, જ્યારે જૈન સમાજ તે દિવસ જ્ઞાનપંચમની આરાધના સાથે ઊજવે છે. આ વરસે જ્ઞાનપંચમી રેટમી એકટોબર ને મંગળવારે ઊજવાશે. આ સપ્રમા દિવસને ધાર્મિક તહેવાર તરીકે ઊજવવા પાછળનો મુખ્ય હેતુ જુવનમાં જ્ઞાનના દીવડા પ્રગાટાવવાનો રહેલો છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર્ય અને તપ એ ચાર મોક્ષ મેળવવાના પાયા છે. તેમાં જ્ઞાનને પણ ભક્તિ, તપ અને ચારિત્ર્ય જેટલું જ મહત્વ આપવામાં આવ્યું છે.

આ દિવસે મુખ્યત્વે પાંચ જ્ઞાનની આરાધના કરવામાં આવે છે. મતિજ્ઞાન, શુત્રજ્ઞાન, અવધિજ્ઞાન, મનપર્યવહજાન તથા કેવળજ્ઞાન. આમ જ્ઞાનનું ગૂટાઈ મહત્વ પૂર્ણ. આ. વિજયલક્ષ્મીસૂર્યિજુએ જ્ઞાનપંચમીના દેવવંદનમાં વિસ્તૃત રીતે સમજાવ્યું છે.

શ્રી સૌભાગ્ય પંચમી તણો,

સચિત દિવસ સ્થિણગાર;

પાંચે જ્ઞાનને પૂજુએ થાય સફલ અવતાર
જ્ઞાનપંચમીએ જિનાલયમાં અથવા ઉપાશ્રય કે આરાધના
જુવનમાં પાંચ પુસ્તકો ઊંચાં બાજઠો પર મૂકીને તેની પર
રૂમાલ મૂકીને વાસક્ષેપથી જ્ઞાનની પૂજા કરવામાં આવે છે.
આમ યથાશક્તિ જ્ઞાનની આરાધના તપ સાથે કરવામાં
આવે છે. આ ઉપરાંત મોટા ભાગનાં જિનાલયો તથા
આરાધના ભવનોમાં ભાવિકો ઝારા કાગળ-કલમ મૂકીને
જ્ઞાનપૂજન કરવામાં આવે છે.

પ્રણમો પંચમી દિવસે જ્ઞાનને,

ગાજે જગમાં જેહ, સુજ્ઞાની,

શુભ ઉપયોગો ક્ષણમાં નિર્જરે,

મિથ્યા સંચિત ખેહ, સુજ્ઞાની

પ્રણમો પંચમી દિવસે જ્ઞાનને

જ્ઞાનની આરાધના વિવિધ પ્રકારે થઈ શકે છે. જૈન
શાસ્ત્રોમાં જ્ઞાનની સમજણ વિસ્તૃત રીતે આપવામાં આવી
છે તેવી જ રીતે અજ્ઞાનની પણ વ્યાખ્યા કરવામાં આવી

છે. અજ્ઞાન બે પ્રકારનાં સમજાવાયાં છે. એક તો કોઈ પણ માહિતી અથવા હકીકતનો અભાવ તો અજ્ઞાન છે જ, પણ વિપરીત બોધ પણ અજ્ઞાન છે, અર્થાત્ જે ચીજમાં સુખ ન હોય કે લાભ ન હોય તેને પણ સુખ માનવું કે લાભનાં દર્શન થવા તે પણ અજ્ઞાન જ છે.

જ્ઞાનપંચમીની આરાધનામાં એકાવન ખમાસણાં, એકાવન અક્ષતના સાથ્યા, શ્રીફળ, સોપારી મૂકીને વિધિપૂર્વક પૂજન કરવામાં આવે છે. ‘ॐ હિં નમો નાણસ્સ’ અથવા ‘ॐ હિં શ્રી વદ વદ વાગ્વાદિનિ સ્વાહા: નમો નાણસ્સ ● નમો સુવદેવચાયે શ્રી સદગુરુદેવ જ્ઞાનલિંગ પ્રગાટાવો’ના ભાવપૂર્વકના જાપ કરવામાં ભાવિકનું ઈષ્ટ થાય તેમ માનવામાં આવે છે. વિશેષ કરીને વિધાભ્યાસ કરતાં બાળકો-કિશોરો ને ચુવાનોને આ માટે પ્રેરણા આપવી ઉત્તમ છે.

જ્ઞાનપંચમીની આરાધનામાં જ્ઞાન સાથે ગુરુનું પણ મહત્વ જોડાયેલું છે. આપણામાં કહેવત છે કે ‘ગુરુ વિના જ્ઞાન નહીં’ એ રૂપે સુગુરુ મળવા અને તેમની પાસેથી જ્ઞાન મેળવવું એ પણ સુયોગ પુણ્યબળે જ મળે છે.

શ્રી જ્ઞાનપંચમીની આરાધના વિશે સુંદર લોકક્થા જૈન શાસ્ત્રોમાં જણાવી છે. આ જ્ઞાનપંચમીની આરાધના કરીને વરદંત જે પદ્મપુર નગરના અજિતસેન રાજના કુંવર હતા તથા ગુણમંજરી તે જ નગરમાં સાત કોટી સુવર્ણના માલિક સિંહદાસનાં પુઅરી, બંને શ્રેષ્ઠ મોક્ષપદ પાખ્યાં. જ્ઞાનની વિરાધના કરવાથી પહેલાં અકલ્ય દુઃખો ભોગવ્યાં અને પૂર્ણ. આ. શ્રી વિજયસેનસૂર્યિશ્વરજુ પાસેથી તે અંગેનું નિવારણ જાણીને સુખો ભોગવીને મોક્ષપદને પાખ્યાં. આમ જ્ઞાનપંચમીની આરાધના કરીને વરદંત તથા ગુણમંજરી વૈજ્ઞાનિક નામના અનુત્તરવાસી વિમાનમાં દેવ થયાં, જે પછીના ભવમાં કેવળજ્ઞાન પામીને મોક્ષે ગયાં.

જ્ઞાનપંચમીની આરાધનાથી સૌભાગ્યની વૃદ્ધિ થતી હોવાથી એને સૌભાગ્યપંચમી પણ કહેવાય છે. રાજના

કુંવર હોવા છતાં પૂર્વભવમાં તીવ્ર જ્ઞાનવરણીય કર્મ બાંધેલાં હોવાથી વરદતને જ્ઞાન ચટ્ઠતું નહોંતું તેમ જ ગુણમંજરી પણ જન્મથી રોગી અને મૂળી હતી. આ બંનેએ ગુરુભગવંતની આજ્ઞા અને આદેશથી જ્ઞાનપંચમીની વિદ્યપૂર્વક આરાધના કરીને એ ભવ તો સુધાર્યો, પણ પછીના ભવે કેવળજ્ઞાન મેળવીને મોક્ષપદ પામ્યાં. આમ જ્ઞાનપંચમીની આરાધના ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક કરવાથી ખૂબ જ લાભદારી રહે છે.

જ્ઞાનપંચમી અથવા સૌભાગ્યપંચમીની આરાધના આ પ્રમાણે કરવી. કારતક માસની સુદ પંચમીએ વિદ્યપૂર્વક

ઉપવાસ કરવો. ઊંચા આસને પુસ્તકાદિ જ્ઞાનની સ્થાપના કરી પુષ્પો તથા વાસક્ષેપથી પૂજા-ધૂપ કરવાં. પાંચ દીવેટનો દીપક કરવો. પાંચ વર્ણનાં ધાન, પાંચ પ્રકારનાં પકવાન તથા પાંચ જાતિનાં ફળ મૂડીને એકાવન સાથ્યા કરવા અને ‘નમો નાણસ’ પદની ૨૦ નવકારવાળી ગણવી. જ્ઞાનનું ચૈત્યવંદન કરવું તથા ૫૧ લોગાસ્સનો કાઉસ્સગા, ત્યાર બાદ યથાશક્તિ ઉજમણું કરવું.

જ્ઞાનપંચમીની આરાધના જૈન વરદત અને ગુણમંજરીને ફળી તેમ તેના સર્વે આરાધકોને ફળે તેવી શુભભાવના સાથે સર્વે આરાધકો અને ભાવિકોને વંદન.

એક રાજ હતો. ચુદ્ધમાં તેની હાર થઈ આથી તે નગર છોડીને ચાલ્યો ગયો. અતિખરાબ હાલતમાં ફરતા

ફરતા એક નગરમાં આવ્યો. તેની નજર એક શેઠ પર ગઈ. શેઠ રાજને પરગાજુ લાગ્યા. રાજાએ પોતાની આખી વાત કહીને સંભળાવી. શેઠનું હૃદય હ્યામચી ગણ્યું. શેઠ રાજને બે લાખ સોનૈયા આપ્યા. રાજાએ સમય જતા બે લાખ સોનૈયાની મદદથી પોતાનું સામાજય પાછું મેળવ્યું!

અહીં હવે શેઠની હાલત ધીરે ધીરે ખરાબ થવા લાગી. શેઠાણીએ શેઠને યાદ કરાય્યું, આપે જેને બે લાખ સોનૈયા આપ્યા હતા તે પાછા માગી લો તો કેવું સારું? પણ શેઠ વિચારે છે કે કોઈને આપેલી મદદ કે દાન પાછું ન લેવાય. પોતે કરમને માનવાવાળા હતા, એટલે તેમણે શેઠાણીને કહ્યું કે, કોઈને આપેલું દાન કયારેય પાછું ન મગાય. અત્યારે આપણા પાપનો ઉદય થયો છે, પણ સમય જતાં બધું બરાબર થઈ જશે. માટે જીવને ટૂંકો ના કરશો. સમય વીતી રહ્યો છે. શેઠની હાલત દિનપ્રતિદિન ખરાબ થતી જાય છે.

એક દિવસ શેઠ રાજમહેલની નજુકથી પસાર થઈ રહ્યા છે. ત્યાં જ રાજની નજર અચાનક શેઠની ઉપર પડે છે. તેમને બોલાવીને હાલચાલ પૂછે છે ત્યારે શેઠ પોતાના કર્મનો ઉદય થયો છે એમ જણાવે છે. રાજ તેમને આશ્વાસન આપી રહેવા ઘર અને એક બકરી

પાપનો અંત, પુણ્યનો ઉદય

■ છાચા પ્રવર કોટીચા

આપે છે અને કહે છે, આનાથી તમારું ગુજરાન ચાલશે. શેઠ બકરીને લઈ જાય છે. બકરીનું દૂધા

પોતાના ખપ પૂરતું રાખીને બાકીનું વેચી નાખે છે. આ રીતે પોતાનો નિર્વાહ ચલાવે છે. બે મહિના આ કમ ચાલે છે ત્યાં બકરી મરી જાય છે. તે શેઠ હતા તેવા થઈ ગયા.

થોડા સમય બાદ રાજ શેઠને બોલાવીને પૂછે છે? કેમ બધું બરાબર ચાલે છે ને? શેઠ કહે છે, હજૂર બકરી તો મરી ગઈ. આ સાંભળીને રાજ શેઠને એક ગાય આપે છે. તે પણ ચાર મહિના જીવી.

ત્યાર બાદ રાજને ખબર પડી કે ગાય પણ મરી ગઈ એટલે એક લેંસ આપી. એક વરસ થઈ ગણ્યું. શેઠ દેખાયા નહીં, એટલે રાજને થયું નક્કી હવે શેઠનું નસીબ ખૂલ્યું લાગે છે! શેઠને બોલાવી સમાચાર પૂછતાં શેઠ કહ્યું કે ભેંસ ખૂબ જ દૂધ આપે છે અને તેને એક પાડી (બચ્ચું) પણ થઈ જે હવે દૂધ આપશે.

રાજાએ મનમાં જે વિચાર્યું તે સાચું હતું. ખરેખર શેઠનું નસીબ હવે ખૂલ્યું છે, એટલે હવે જે આપીશું તે ટકશે. તેમ વિચારીને શેઠને દસ લાખ સોનૈયા આપ્યા. શેઠ સુખી થઈ ગયા. નસીબ વગર કંઈ મળતું નથી અને મળે તો ટકે નહીં. શેઠના સમતા ભાવના હિસાબે તેમનો પાપોદય જલદી મરી ગયો અને પુણ્યોદય ફરી જાગૃત થયો.

૨ - સુખ શામાં છે ?

નાના બાળકથી માંડી વૃદ્ધ સુધી, સ્વી હોય કે પુરુષ, પણ દરેકના હૃદયમાં સુખ પ્રાપ્ત કરવાની ભાવના હોય છે. દરેક વ્યક્તિ

પોતાના સુખના આદર્શની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરતી માલૂમ પડશે, પછી જેવો જેનો આદર્શ. કોઈ પૈસાની પ્રાપ્તિમાં તો કોઈ કીર્તિમાં તો કોઈ સંતતિમાં સુખ શોધતા માલૂમ પડશે. દસ ઇપિયા કમાનાર સો ઇપિયા મેળવવા મહેનત કરી રહ્યો હશે, ત્યારે સો મેળવનાર હજાર પેદા કરવાના સ્વખન સેવી રહ્યો હશે. હજારનો માલિક લક્ષાધિપતિ બનવાના મનોરથ સેવી રહ્યો હશે. પગો ચાલનાર મોટરના સ્વખન માણતો જણાશે. દરેક વ્યક્તિ જીવનમાં કંઈ ને કંઈ ઊણાપ જરૂર અનુભવે છે અને એ ઊણાપ એના દુઃખનું કારણ હોય છે. ચાંદે એ ઊણાપ ઘનની હોય અથવા કીર્તિની કે સંતતિની. કોઈને પણ પૂછશો, ‘કેમ છો?’ તો તરત જ એ પોતાનાં દુઃખનાં રોદણાં રડવા બેસી જશે. પોતે પરમસુખી છે એવું કહેનાર તો કોઈ વિરલ જ હશે. સુખ મેળવવાની લાલસા તો સંદૈવ દરેકના હૃદયમાં સળગતી જ હોય છે. પોતે જે વસ્તુઓથી સુખ મેળવવાની આશા રાખી હોય તેવી વસ્તુઓના અભાવે નિરંતર પોતાને દુઃખી માની બેસે છે.

શ્રીમંતાઈના વૈભવમાં મહાલનાર સંતતિનો અભાવ અનુભવી દુઃખી થાય છે અને જો સંતતિ અને સંપત્તિ બન્ધે હોય તો કીર્તિ મેળવવા ફાંફાં મારતા હશે.

દરેક વ્યક્તિ કંઈ ને કંઈ અપૂર્ણતા અનુભવે છે. સુખની વ્યાખ્યા આપણે આપણી માન્યતાઓ પ્રમાણે કરીએ છીએ અને એની પ્રાપ્તિ માટે રાત-દિવસ દોડાદોડ કરીએ છીએ છતાં અસંતોષની જવાટા સંદૈવ આપણા હૃદયમાં સળગતી જ રહે છે. અજ્ઞાનતાથી આપણે વિચારી પણ નથી શકતા કે સર્વ કંઈ હોવા છતાં શા માટે આપણે અસંતોષ અનુભવીએ છીએ? એવી કોઈ વસ્તુ નથી કે જેથી આપણે પરમસુખ પ્રાપ્ત કરી શકીએ. શાલિભદ્ર જેવા પરમવૈભવમાં મહાલનારને પણ એક દિવસ પોતાના સુખની ઊણાપ સમજાય છે અને સાચું સુખ પ્રાપ્ત કરવાની તીવ્ર આકંક્ષા જાગે છે. આપણા પૂર્વપુરુષોએ સર્વસ્વ ત્યાગી પરમસુખને શોધી કાટ્યું હતું એ આપણે જાણીએ છીએ, સમજુએ છીએ, છતાં આપણે તો એ જ વસ્તુઓમાંથી સુખ શોધવા મથીએ છીએ કે જેમને તેઓએ દુઃખના કારણાર્થ સમજુ તજુ દીધી હતી. એક માંદા માણસે અને મૃત્યુએ લગભગ બુદ્ધના જીવનમાં પરિવર્તન

તમે અને ધર્મ

■ સંકલન: અલ. ચુ. શાહ

કરી દીદું ત્યારે આપણે જીવનમાં અનેક માંદગીઓ ભોગવવા છતાં, સેંકડો મૃત્યુઓ જોવા છતાં, જરાય પરિવર્તન નથી કરતા!

જૈન ધર્મમાં કોઈ એવી ભાગ્યે જ કથા

હશે કે જેનો અંત ત્યાગમાં નહિ આવતો હોય. કથાનો નાયક કે નાયિકા જીવનને અંતે ત્યાગને પંથે પડે છે. આપણે એવી કથાઓ હંમેશાં વ્યાખ્યાનોમાં સાંભળીએ છીએ કે જેનો નાયક સ્થળે સ્થળે વિજય મેળવતો નવીન નવીન લીઓને મેળવી ખૂબ સમૃદ્ધ મેળવે છે. ત્યાં સુધી તો આપણાને એ કથામાં ખૂબ રસ આવે છે અને એવા ભાગ્યને દીઢીએ છીએ, પણ કથાના અંતમાં જ્યારે નાયકને સર્વસ્વ ત્યાગી પરમસુખની પ્રાપ્તિ માટે ત્યાગ માર્ગો વિહરતો સાંભળીએ છીએ ત્યારે કહીએ છીએ કે એ કાળ જુદો અને જીવ પણ જુદા! માત્ર એમના ત્યાગની પ્રશંસા કરી આત્મસંતોષ અનુભવીએ છીએ કે અમારા પૂર્વજો આવા સમર્થ હતા. આપણે એમની સંપત્તિ અને સદ્ભાગ્યની દીઢા સેવીશું પણ એમના ત્યાગની નહિ!

નવા વર્ષના દિવસે ચોપડામાં ગૌતમરવામીની લાંદ્ય અને શાલિભદ્રની રિદ્ધિસિદ્ધ સૌ દીઢે છે, પણ ગૌતમરવામીનો શ્રી મહાવીર પ્રત્યેનો પ્રેમ કેટલા દીઢે છે? સત્યની ખાતર ધર્મ ત્યાગવા જેટલી ઉદારતા કેટલા સેવે છે? શાલિભદ્રની રિદ્ધિ દીઢણાર આપણે એ રિદ્ધિને ત્યાગવાનું સામર્થ્ય નથી દીઢતા. એમણે વૈભવવિલાસ પણ માણી જાણ્યો અને ત્યાગ પણ. આપણે એમના વૈભવ માટે તલસીએ છીએ, એમના ત્યાગ માટે નહિ!

આપણે સુખ શોધીએ છીએ, ત્યાગમાં નહિ પણ ભોગમાં કે જેની કદી તૃપ્તિ થતી જ નથી. દરરોજ ત્યાગમાર્ગની કથાઓ સાંભળવા છતાં પણ જીવને ત્યાગમાર્ગો વિહરવાનું મન થતું જ નથી. દરરોજ ત્યાગમાર્ગની વાત સાંભળવા છતાં એને સ્પર્શ્યા વગર જ ચાલી જાય છે. વૃદ્ધાવસ્થામાં ધંધામાં બદ્ધું ખોઈ દેનાર બે વર્ષ સારાં આવશે તો પાછું બદ્ધું જમાવી લઈશું એ જ ભાવના સેવ્યા કરે છે. સંસારમાં અનેક કઠિનાઈઓનો સામનો સહન કરનારને લાગે છે કે હવે થોડા સમય પછી પુણ્યોદય થશે તો બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે અને એ ફરી સંસાર સુધારી શકશે. એમના મનમાંથી નવા સંસાર વસાવવાની ભાવના જ દૂર થતી નથી. ઐહિક સુખોની સમસ્ત જીવન સમાપ્ત કરવા છતાંય તૃપ્તિ નથી અનુભવતો. એની એ વસ્તુ પ્રાપ્ત કરવા મથે છે અને

પરિણામે સંસારની વૃદ્ધિ થતી જાય છે.

પાસે લાખો રિપિયા હોય, પતિ-પત્ની બે જ જણ હોય, છતાં પુરુષ રાત-દિવસ ધંધામાંથી નવરો જ ન પડે. પોતે કોને ખાતર આ બધું કરે છે એ વિચારવાનો પણ એને સમય ન હોય. હવે બસ થયું અને ત્યાગમાર્ગ વિચરી પરમ સાધન સુખ પ્રાપ્ત કરવા નીકળીએ, એ ભાવના તો બાજુએ રહી, પરંતુ વર્ષમાં એક-બે માસ કોઈ સંત-સાધુના સમાગમ માટે પણ આપણાને ફુર્સદ ન મળે.

આપણે ધાર્મિક કિયાઓને પણ દરરોજની એક કિયાથી વિશેષ સ્થાન જીવનમાં નથી આપતા. જેમ ખાવું જોઈએ, કપડાં પહેરવાં જોઈએ, તેમ જે ધર્મમાં જન્મ્યા તે ધર્મની કિયાઓ કરવી જોઈએ, એમ માની તેટલી કિયાઓ કરી ધર્મદ્યાન કરીએ છીએ. એ જ ધંધો, સગાં-સંબંધી, લગન-વિવાહમાં મગન બની જીવન પસાર કરીએ છીએ. ત્યાગીઓની અને ત્યાગમાર્ગની પ્રશંસા કરીએ છીએ, પરંતુ જો આપણા જ ઘરનો કોઈ યુવાન સંસારના કલેશથી કંટાળીને સુખની શોધ અર્થે દીક્ષા લેવાની ઈચ્છા કરે તો કેટલાં મા-બાપો એવાં નીકળશે કે જેઓ કહેશે, ‘ધન્ય છીએ અમે કે જેમના ઘરમાં આવો ત્યાગી દીકરો પાકર્યો.’ આપણે તો એને એના માર્ગથી વિચલિત કરવા પ્રયત્ન કરીશું. પતિત ત્યાગીઓના દાખલા આપીશું.

ત્યાગમાર્ગ સુખ મળે છે એમ જો આપણે ખરેખર માનતા હોઈએ તો ત્યાગની ઈચ્છા રાખનારને આપણે વધાવી લઈશું. પુત્રનાં લગનથી પરમસુખ અનુભવતાં મા-બાપ નવપરિણીત પુત્રને દીક્ષિત થતો જોવામાં આનંદ અનુભવી ન શકે. પુત્ર પ્રત્યેના મોહને લીધે તેઓ દુઃખી થાય, પરંતુ જો મા-બાપ ત્યાગમાર્ગની ઉત્કૃષ્ટતા સમજતાં હોય તો એટલું સમજું શકે કે પોતે ખોટે માર્ગ છે, પણ પુત્ર તો સત્યના પંથે જ વિચરી રહ્યો છે, પણ આપણે તો પુસ્તકોમાં લખેલી ત્યાગની વાતોમાં રહેલા ત્યાગને જ વખાણીએ છીએ. ખરું સુખ તો સંપત્તિ-સંતતિમાં જ માની એમાં જ મસ્ત રહીએ છીએ. પુત્ર-પુત્રીઓને પરણાવવાં ને પૌત્ર-પૌત્રીઓને રમાડવામાં જ જીવનનો પરમ લહાવો માનીએ છીએ. પોતાના પુત્રને ત્યાં પુત્ર હોય તો મા-બાપ એક જ ભાવના સેવે કે કયારે પૌત્ર રમાડીએ, પણ કયારે પુત્ર પગભર થઈ જાય ને અમે ત્યાગને પંથે વિચરીએ એ ભાવના કેટલા સેવતા હશે?

કોઈ ત્યાગી મહાત્મા પાસે પણ શાંતિની ઈચ્છા નહિં, પણ સંસારી ઈચ્છા રાખીને જઈએ છીએ, એમની પાસેથી

શાંતિને બદલે સંતતિની પ્રાપ્તિના આશીર્વાદ મેળવવાનાં સ્વભ સેવીએ છીએ. એમના આશીર્વાદથી દરદોથી મુક્ત થઈ જવાની આશા રાખીએ છીએ અને એટલા માટે જ એમનો સમાગમ ઈચ્છીએ છીએ. આપણે સંસારસુખમાં એટલા બધા લાલચું બની ગયા છીએ કે ત્યાગીઓ પાસેથી પણ સાંસારિક સુખ ઈચ્છીએ છીએ. એમનાં ત્યાગ કે જ્ઞાન સાથે આપણાને કશી લેવા-દેવા નથી રહેતી. ત્યાગની વાતો નિત્ય સાંભળવા છતાં એ આપણાને સ્પર્શયા વિના જ ચાલી જાય છે.

કોઈ વાર તો માંદંગી અને ધંધામાં ગાયેલી નિષ્ફળતા કે પુત્રપ્રાપ્તિ માટે દેવદેવીઓની કે તીર્થસ્થાનોની માનતાઓ રાખી આપણે આપણાં સંસાર પ્રત્યેની તીવ્ર આસક્તિનું દર્શન કરીએ છીએ. આપણાને સુખ જોઈએ છીએ, એની પ્રાપ્તિ માટે અહીં-તહીં દોડાદોડ કરીએ છીએ, આપણાં માન્યતાઓ મુજબનાં સુખો મેળવવા પ્રયત્નો કરીએ છીએ, પણ આપણાં આત્મા સાચા સુખને બરોબર ઓળખે છે. આપણે લાવી આપેલી જૂઠી વસ્તુઓથી એ ઠગાતો નથી અને પરિણામે સદા અસંતોષ જ અનુભવીએ છીએ. એનું કારણ આપણે સમજતા પણ નથી અને સમજવાનો પ્રયત્ન પણ કરતા નથી. વાસનાઓની તૃપ્તિઓમાંથી કદી કોઈએ સુખ પ્રાપ્ત કર્યું આપણે સાંભળ્યું નથી. છતાં આપણે તેમાંથી જ સુખ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરી સદા નિષ્ફળતા મેળવીએ છીએ અને જીવનમાં દુઃખ અનુભવીએ છીએ.

જ્યારે આપણા મનની વૃત્તિઓ સંસારને બદલે આત્મા તરફ વળશે ત્યારે જ આપણે સાચા સુખની ઝાંખી કરી શકીશું. જ્યાં સુધી મનની વૃત્તિઓ સંસાર તરફ ઉન્મુખ હશે ત્યાં સુધી કદાચ કાણિક વૈરાગ્યને વશ થઈ ત્યાગ કરીશું, તોપણ એ વૃત્તિઓ નાશ નહિં પામે. વૃત્તિઓ કાયમ રહેશે, માત્ર એમનું કાર્યક્ષેપ બદલશે.

સંતાનપ્રાપ્તિની લાલસા અને શિાષ્યો મેળવવાની લાલસા એમ જ રહેશે. શ્રીમંત અને પ્રતિષ્ઠિત સગાં-સંબંધીઓ સાથે સંબંધ રાખવાની વૃત્તિ એવા ભક્તો મેળવવાની વૃત્તિ બની જશે. હજારો રિપિયા ખર્ચી ભજકાભર્યા લગનમહોલ્સવો કરી પ્રતિષ્ઠા મેળવવાની વૃત્તિ બની જશે. કોઈ તપ કે એવા જ કોઈ ધાર્મિક મહોલ્સવમાં મોટા ખર્ચી કરાવી નામના મેળવવાનો મોહ જગાડશે. વૃત્તિ એ જ હશે, માત્ર કાયર્યો જુદાં.

મનને આત્મા તરફ વાળવાથી જ સાચા સુખનો માર્ગ સમજશે અને ત્યારે જ જીવનમાં ગતિ સ્થાપિત થશે. સંસારમાં રહી સર્વ કાર્યો કરવા છતાં આપણાને સંસાર નહિં સ્પર્શે.

IMPROVE YOUR HEALTH SAFELY LOSE WEIGHT AND LIVE LONGER



Being overweight causes serious health risks such as Diabetes, Hypertension, Cardio Vascular Diseases, Strokes, Arthritis. People get treated for their symptoms like Joint pain, Breathlessness, Blood Pressure, increase in Blood Sugar but the main culprit is "Obesity", which often goes untreated. Weight loss prevents development of other lifestyle diseases as well and may reduce the need for medications that you may be on.

At CSI, we offer various options for weight loss which are always under the supervision of Team of Experience Physicians, Endocrinologist, Dieticians and other Specialists. Programmes offered include surgical as well as non-surgical options based on your requirement.

NON-SURGICAL PROCEDURES INCLUDE

Weight loss through Diet (upto 10 kgs) This programme includes complete dietary and life style assessment by our Team of professionals. After the initial assessment required dietary as well as lifestyle changes are recommended by our experts. Regular follow up sessions are instituted till the desired weight loss has been achieved. The diet recommend is simple and easy to follow and will be tailored to your requirements and taste.

CSI Beta - Diet Plan; (A healthy, New You!) Imagine a new you just 40 days from now, 10 kgs lighter. Sounds unrealistic? But it's true. Celebrities have known of this secret diet for years and it has gained popularity recently. The CSI Beta -Diet weight loss plan will leave you amazed with its incredible, "lasting results" as your metabolism resets to a healthier level. Weight loss is guaranteed if you stick to the protocol.

What is the CSI Beta – Diet Plan? The CSI Beta - Diet plan consists of nutritionally well balanced low calorie diet accompanied by a small dose of HCG. Most of our patients that were compliant lost an average of 10 kgs in just 40 days. In addition to loss of unwanted fat, the true benefits of the Beta -diet plan is its ability to modify the dieter's relationship with Food & Eating, resulting in easily maintainable, long term weight loss. This plan can be safely used by men and women.

Advantages of CSI Beta Diet plan over other Diet Plans:

- Resets your metabolism
- Reshapes your body by losing stubborn, abnormal fat in unwanted areas.
- No intensive exercise programme. • No surgery • No packaged food • Medically supervised.

We also offer other surgical options for Weight Loss:

- Body contouring Surgery Liposuction & Tummy Tuck for instant shape change.
- Bariatric Surgery - For people who are moderately to Morbidly obese.
- Intraoperative-balloon is a day care procedure which can result in average weight loss of 10 to 15 Kgs.

Discounts upto 25% on Consultations & Procedure

Call: 91-22- 6733 7500 / 2661 7575

8th Floor, Mangalmurti (Jack & Jones Building), Linking Road, Santacruz (W), Mumbai.54


The Cosmetic Surgery
Institute®

ભારતના શ્રેષ્ઠ પણ વિશ્વની શ્રેષ્ઠ છે

ADVT

૧૩

ઓક્ટોબર ૨૦૧૪

COME AND EXPERIENCE AN UNMATCHED LIVING SPACE SPREAD OVER 22 ACRES



Actual Site Photograph

Ready to glance: Exclusive Sample Villas • Grand Entrance Facade • Internal Roads

MANGALYAM
meadows
DISCOVER LIFE
Chanvai Village, Valsad

The glimpse of exclusivity: 412 beautifully designed villas | Nearly 3 km of internal roads with ornamental street lighting | Large water body at the entrance with night lighting | Enchanting water fountains and large landscaped gardens at various locations within the project | Grand and opulent clubhouse spread over 40,000 sq. ft. (approx.) over a water body having a swimming pool with wooden deck, open air cafe, 84 seater private theatre, separate children's theatre, 3000 sq. ft. banquet hall with attached 12,000 sq. ft. of lawn area, fully-equipped gymnasium, spa, soundproof discotheque, colonial styled library, 14 fully-equipped guest bedrooms and a host of other amenities

Disclaimer : The information in this ad is indicative of the kind of development that is proposed. Subject to the approval of the authorities or in the interest of continuing improvement, in the leaflets/ brochures or any other printed material, are only indicative and artistic imagination, may not be exact or accurate, and the same does not form either the basis or part



Dalal Gruh & Infra Projects presents Mangalyam Meadows, a superior villa living near Valsad, where life unfolds the best of exclusive living. Adorned with new-wave features and best-in-class amenities, Mangalyam Meadows is nothing but a glorious manifestation of a supreme life amidst nature.



- Large Water Body at the Entrance

BOOKINGS ARE OPEN

Call: 90290 94922, 86550 94922 | www.mangalyammeadows.com

Mumbai Sales Office: 43, 1st Floor, Swastik Plaza, V.M. Road, Juhu, Next to Kala Niketan, Vile Parle (W), Mumbai - 400056

Sales / Site address: Mangalyam Meadows, Chanvai Rabda Road, Chanvai Village, via Atul, District: Valsad - 396020

Call: 93281 94922 / 93272 94922 | sales@mangalyammeadows.com

These developers reserve the right to change the layout, plans, specifications or features without prior notice or obligation. The details, images, sketches and elevation contained in the offer or contract. The area shown in the plan includes the column offsets and plaster thickness.



સર્વ જૈન જગ્યાતિ સેન્ટરના ભાનનીય પદાધિકારીઓ
તથા
માનવંતા સભ્ય ભાઈ-બહેનોને

બુલાની

વાષ્પાન્નિંદળ

જૈન જગ્યાતિ સેન્ટર સેન્ટ્રલ બોર્ડ

ચેરમેન	: શ્રી રમેશ જે. મોરબિયા
તા.બૂ.પુ.ચેરમેન	: શ્રી જિતેન્દ્ર અેસ. કોણારી
કાઉન્સિલ ચેરમેન	: શ્રી ચીમનલાલ એસ. ગોસલિયા
વાઇસ ચેરમેન	: શ્રી સંજય જી. શાહ
	શ્રી દીનેશ ચેલ. નાથાવટી
સેકેટરી જનરલ	: શ્રી પ્રકુલ્પ વી. કામદાર
સેકેટરી	: શ્રી કિશોર એસ. શેઠ
	શ્રી જયંતિલાલ કે. ધાડવા
	શ્રી ઉદ્ય ડી. સંઘદી
	શ્રી દ્વિજેશ પી. શાહ
દેવલપમેન્ટ સેકેટરી	: શ્રી અનિલ જી. દોશી
ખજાનચી	: શ્રી રાજેશ સી. ગાંધી
	શ્રી રાજેશ આર. ભણસાલી
તંત્રી	: શ્રી રમેશ એમ. સંઘદી

જેજેસી-સેન્ટ્રલ બોર્ડ યોર્કિટેબલ ટ્રસ્ટ-કમિટી

ચેરમેન	: શ્રી કિશોર એન. શાહ
તા.બૂ.પુ.ચેરમેન	: શ્રી હિરણ્ય એચ. શાહ
વાઇસ ચેરમેન	: શ્રી ચંદ્રવદન આર. શાહ
વાઇસ ચેરમેન	: શ્રી રમેશ જે. મોરબિયા
સેકેટરી	: શ્રી જિતેન્દ્ર એસ. કોણારી
સેકેટરી	: શ્રી સંજય જી. શાહ
લે. સેકેટરી	: શ્રી પ્રકુલ્પ વી. કામદાર
ખજાનચી	: શ્રી ઉદ્ય ડી. સંઘદી
સહખાનચી	: શ્રી અનિલ જી. દોશી

સમયક શ્રદ્ધા જ સ્વ-પર કલ્યાણાકારક

■ ગુણવંત બરવાળિયા

મિત્રોમાં ચર્ચા ચાલતી હતી, શ્રદ્ધા, અશ્રદ્ધા અને અંધશ્રદ્ધાની. સારી શ્રદ્ધા માનવીને તારે, અશ્રદ્ધા જીવનને જડતા તરફ લઈ થાય, અંધશ્રદ્ધા ફૂલાડે.

અંધશ્રદ્ધા વ્યક્તિગત જીવનમાં નેતૃત્વ અધ્યપતન કરાવે. આધ્યાત્મિક પ્રગતિ જ ન થાય, કારણ ભિથ્યાત્મમાંથી જરાક પણ પગ બહાર ન કાઢી શકે.

અંધશ્રદ્ધા સમાજ માટે કેટલી નુકસાનકારક છે તે સંદર્ભે મિત્રો એક રસપ્રદ જ નહિ ચિંતનપ્રેરક વાત કરી.

થોડા દિવસ પહેલાં એક અનાથાલયની મુલાકાતે જવા માટે અમે કેટલાક મિત્રોએ એક ર્થળે મળવાનું નક્કી કર્યું. સર્વધાર્મ મંદિર મુક્તિધામ-નાશિક અને વિવિધલક્ષી મહારૂગણાલય-હોસ્પિટલ બજેટ વચ્ચેના સંકુલમાં આવેલ બગીચાની એક બેંચ પર બેસીને હું મિત્રોની રાહ જોતો હતો, એવામાં હોસ્પિટલ બાજુથી પાંચેક વ્યક્તિ આવી બાજુમાં-નજુકમાં જ બેઠી.

બે પુરુષો, બે સ્ત્રી અને એક ૧૮ વર્ષનો યુવાન. વાતચીત પરથી જાણ્યું કે બે પુરુષો પિત્રાઈ ભાઈઓ હતા. તેમાંના એક ભાઈનો ૧૮ વર્ષનો યુવાન પુત્ર હોસ્પિટલમાંથી સાજો થયો હતો અને તેને છુફ્ટી મળી હતી. એક સ્ત્રી તે યુવાનની માતા અને બીજી દાદી હતી.

‘આ હોસ્પિટલ બનાવનાર સૌ ધન્યવાદને પાત્ર છે. જેણે આમાં દાન આપ્યું છે તેણે તો પુણ્યના ગંજ ખડકી લીધા છે,’ છોકરાના પિતા બોલ્યા. આ સાંભળી બીજા ભાઈએ કહ્યું કે ‘તારી વાત સારી છે. આપણે પહેલાવહેલા છોકરાને ખાનગી ડોકટર પાસે લઈ ગયા હતા તો તેણે આઠ છલાર ખર્ચ આવશે તેમ કહેલું. આટલા રૂપિયા આપણે ગારીબ માણસ કર્યાંથી લાવીએ. સાદું થયું કે આપણે આ વિવિધલક્ષીમાં આવ્યા. દસ દિવસે છોકરો સાજો થયો અને આ ધર્માદા દવાખાનાનું બિલ તો પંદરસો રૂપિયા જ આવ્યું.’

દાકતર તો દેવ જેવા ને આ નર્સ તો દયાળું પરી જેવી. છોકરાની ઊભે પગે ચાકરી કરી. ભગવાન એનું ભંનું કરે! માણ્યાએ અંતરના આશીર્વાદ આપ્યા.

આપણું કામ સારી રીતે પાર પડી ગયું તો માતાજુના મટે જઈને જ ગામને ઘરે જઈએ, મોટો ભાઈ બોલ્યો. નાનો કહે માતાની જગ્યાએ જવાનું કેટલું ખર્ચ થશે. નાળિયેર, પૂજાપો, ચૂંદ્યો, ફૂલમાળ, પૂજારી અને પ્રસાદના થઈને

વધામણાંના સાડા ચારસો જેવા ને દોટસો ટિક્કિટના ગણીએ તો છર્સો રૂપિયા ખરચ થાય, મારી પાસે અણાસો સવા પ્રણાસો સિલિક છે. અણાસો તારે ઉછીના આપવા પડશે. મોટાએ બજેટ રજૂ કર્યું.

રસ્તામાં દંટાળીમાની દેરીએ એક ઘંટ પણ ચડાવતા જઈએ. દોટસો વધુ થાશે. હું સાડા ચારસો ઉછીના આપીશા. સગાવકે પાછા આતાજે. દવાખાનાનું બિલ વધુ આવ્યું હોત તો ભરવું જ પડત ને, માના પરતાપે તો સૌ સારાં વાનાં થયાં. નાનાએ ટાપશી પૂરી.

આમાં તો આખો દી ભાંગી જશે, છોકરાની માએ કહ્યું. તે તારે કચા આજે જ હળે જુતવા જાવું છે. છોકરાના બાપે એને ટપારી.

છોકરો માંડ પથારીમાંથી ઊભો થયો છે. દાકતરે હજુ આઠ દી પરેજુ પાળવાની અને ઘરની બહાર નહિ નીકળવાનું કહ્યું છે. છોકરાને હજુ નબળાઈ બહુ છે. આ દેવી-દેરાનાં વધામણાંનું પછી રાખો તો સારું ભાઈ, દાદીએ વ્યથા રજૂ કરી.

આ સાંભળી હું બોલ્યો, ભાઈએ તમારે કચાં રે’ધું. સાંભળી મોટો ભાઈ કહે, સાપુત્રારા બાજુને ગામડે રહીએ છીએ. છોકરાને દવાખાને દાખલ કર્યો’તો. આજ છુફ્ટી દીધી. હવે ઘરે જાવું છે, પણ જાતા પેલા છોકરાને માતાજુને પગે લગાડતા જાવું છે.

તમે આ ધર્માર્થ દવાખાનાનું બનાવનાર દાનવીરો અને ડોકટરનાં વખાણ કર્યા તે સાંભળ્યું. તમે એની કદર કરી તે મને ગમ્યું, પણ તમે દેવું કરી ઉછીના-ઉધાર લઈ માતાજુનાં વધામણાં કરવા જવાનો વિચાર કરો છો તે કેટલું યોગ્ય. દંટાળીમાના દેરે બસ્સો ઘંટ પડયા છે. માણસો યોરીને ઘંટ ભંગારમાં વેચી દે છે. રાખવાની જગાના અભાવે પૂજારી પણ ઘંટ વેચી દે છે. આને બદલે તમે જે ધર્માદા દવાખાનામાં લાભ લીધો તે દવાખાનાના ટ્રેસ્ટને રી. ૨૫૧ દાનમાં દો તો તમારા જેવા જરૂરિયાતવાળાના ઉપયોગમાં જ એ રકમ વપરાશે. તમે કહેતા હતા ને કે આ દવાખાનામાં દાન દેનારે પુણ્યના ગંજ ખડકીયા તો તમે પણ યથાશક્તિ આપી પુણ્ય કમાઈ લો, મેં કહ્યું.

ધરમ-કરમ તો કરવા જ જોઈએ ને, નહીં તો દેવ ના કોપે? નાનો બોલ્યો.

સામે મુક્તિધામમાં સર્વધર્મનાં દેવ-દેવીઓની સુંદર મૂર્તિઓ છે. ત્યાં જઈ ભાવપૂર્વક છોકરાને દર્શન કરાવો અને તમે બધા પણ દર્શન કરો. મંદિરના ભંડારમાં રા. ૫૧નું દાન કરો. શ્રદ્ધાપૂર્વકનાં દેવદર્શન તમારા પરિવારનું જરૂર કલ્યાણ કરશે.

આમ કરવાથી તમે દેવું કરવામાંથી પણ બચશો અને છોકરો મુસાફરીથી બચી ઘરે આરામ કરી શકશો, મેં આત્મીયભાવે બજે ભાઈઓને કહું.

આ ભાઈની વાત સારી છે. દાદીએ કહું. બધા સંમત થયાં. નાનો કહે હોસ્પિટલમાં જઈ બસો એકાવનની પાવતી ફડાવીને આવું છું. તમે સો મંદિર તરફ ચાલો. દર્શન કરીને ગામને ઘરે જ જઈએ.

મોટા ભાઈએ ચાલો ત્યારે રામ રામ કરી સ્મિત કર્યું તે કણે મને પ્રસ્કૃતા અને સંતોષની લાગણી થઈ.

આરોગ્યનાં સ્તુત્રો Health is Wealth

■ ધનસુખ અમરશી મોરબીઆ, દાદર

શિયાળામાં તલ, શરીર કરે ખડતલ,
અવળીનાં પાન, સુંદર બનાવે વાન,
ચાના બદલે ચણા, તો જીવે ઘણા,
ખાંડના બદલે ગોળ, તો હાથમાં આવે જોર,
જે ખાય ભાજુ, તેની તબિયત તાજુ,
જે ખાય મગા, તેના જોરમાં ચાલે પગા,
જે પીવે બીડી, તે ચકે રોગોની સીડી,
તુલસીનાં પાન, દિલમાં લાવે જાન,
બેડ અને પાઉં, તબિયત કરે ચાઉં,
લેળપૂરી અને ભાજુપાઉં, કમળો કહે હું તને ખાઉં,
લીલી ભાજુનું શાક, જલદી ઉતારે થાક,
ચાના બદલે રાબ, તો વધે ઝાબ,
આમળાં ને જમફળ, આરોગ્ય રાખે સફળ,
જે ખાય વાસી ભજિયાં, તો પેટમાં થાય કજિયા,
પેટમાં ઊપડે પીડા, તો ફાકો અજમો,
લીલી ભાજુ, આંખો રાખે તાજુ,
વાસી ખાય ગોટા, તો ઝટપટ ભરાવે લોટા,
કુલફી ને ગોલા, કરી નાખે પોતંપોલા,
સાજ ખાય રોટલા, માંદા ખાય રૂપિયા,
ઘણો મસાલો, દેહનો કસાલો,
કેટલા ભોગવો ભોગ, તેટલા મેળવો રોગ,

ભિત્ર પટેલે ઘટનાની વાત પૂરી કરતાં મારા મનમાં ચિંતનની ચિનગારી ચાંપી.

સંતો અને લોકશિક્ષકો સમાજના એક મોટા વર્ગને અંધશ્રદ્ધમાંથી બચાવી શકે.

આવા એક મોટા વર્ગનો પૈસો અને સમય બાધા, આખડી, દોરા, ધાગા, ભૂવા, ડાકલા પાછળ વ્યર્થ ખર્ચાતો બચે અને એ સમય અને નાનકડી પણ વિશાળ સંપત્તિનો પ્રવાહ શિક્ષણની સંસ્થાઓ, વિધાલયો, આરોગ્યની સંસ્થાઓ, હોસ્પિટલો પ્રતિ વળે તો એ બધું મળીને કેટલું મોટું કામ થઇ શકે. નહિં તો વેઠિયા ઘંટી ચાટે ને પૂજારીને મળીદા જેવો ઘાટ થાય.

સમ્યક્ શજા જ ધર્મનો પાયો છે અને તે જ સ્વ-પર કલ્યાણનું કારણ બની શકે.

કરિયાતું અને વડું, તાવનું ઓસડ વડું,
આંખે પાણી, દાંતે લૂણા, પેટ ન ભરો ચારે ખૂણા,
મસ્તકે તેલ, કાને તેલ, રોગ તનના કાઢી મેલ,
શરીરે દુઃખી, તે દુઃખી સર્વ વાતે,
શરીરે સુખી, તે સુખી સર્વ વાતે,
લાંબું ભોજન ઢૂંકી જિંદગી, ઢૂંકું ભોજન લાંબી જિંદગી,
ભોજનાલય એટલે ભોજન કરવાનું છે સ્થાન,
થવા ન દેશો કોઈ દી ભર્યલા, એને કબૃસ્તાન,
શરીર તો બસ શરીર છે, રાખો એવું ભાન,
શરીરને ના બનાવો, દવાઓની દુકાન,
મધ, આવું રસ મેળવી, ચાટે પરમ ચતુર,
શાસ, શરદી, વેદના, યોક્કસ નાસે દૂર,
પેટ સાફ રોગ માફ, રોગ વગારનું તન, જાણો એક ઉપવન,
પહેલું સુખ તે જાતે નરવા, બીજું સુખ ખાવું ભાવે,
ત્રીજું સુખ તે ઝડપો ઉતરે, ચોથું સુખ તે નીંદ આવે,
સાચું સુખ સંસારનું, દેહ નિરોગી હોય,
કરોડપતિ શું કામનો, દંડનો કુગર જો હોય,
ખાવું તો તોળી તોળી, પીવું તો ઘોળી ઘોળી,
સૂંધું તો રોળી રોળી, એ ઓસડ ને એ ગોળી,
કંકું માણું, હળવું પેટ અને હૂંકાળા પાય,
એવું જણા ના કોઈ દી દાકતર પાસે જાય,
જમતાં પહેલાં જળ નહીં, વચમાં પીવે વીર,
પહેલાં છેવટ બે વખત આચમન લેવું નીર,
ઓછું બોલે, ઓછું ખર્ચ કરે, ઓછું ખાય,
તે માનવી લાંબું, ચિંતા વિનાનું, નિરોગી જુવન જીવે,
ઉંઘો સૂવે અભાંગો અને ચાતો સૂવે રોગી,

ડાબા તો સૌ કોઈ સૂર્યે, જમણે સૂર્યે જોગી,
હૃદયરોગની દવા અનુપમ સાજડવૃક્ષની છાલ,
પીજે કરીને કવારા તો સદાચ કરશે ગોપાલ,
મગ કહે હું લીલો દાણો મારે માથે ચાંદાં,
બે-ચાર મહિના ખાય તો માણસ ઉઠાડું માંદા.

—૦૦૦—

જીવનહકારની વાતો

- ૧) છ ખંડને જીતનારા ચક્કવર્તી કરતાં પણ પાંચ ઈન્ડ્રિય અને છહું મનને જીતનારા શ્રેષ્ઠ ગણાય.
- ૨) ‘થોડું બોલો, થોડું જમો અને થોડું સૂર્યો.’ એથી સાધનામાં શીદ્ધ પ્રગતિ થશે.
- ૩) હંમેશાં સ્વાદ, વાદ અને ચાદ કે ફરિયાદ જ માણસને સત્તાવતી હોય છે.
- ૪) સદાચાર, સદવિધા, સલ્કર્મ અને સત્તસંગ એ આત્માના અલંકારો છે.
- ૫) દાન કરવા માટે આવક વધારવાની નહિં, ખર્ચ ઘટાડવાની જરૂર છે, એ સૂર્ય ભૂલતું નહિં.
- ૬) પૈસા કમાવા સહેલા છે, પણ વાપરવા અધરા છે, એને માટે કાળજું જોઈએ.
- ૭) વ્યક્તિની એક જ વખતની ભૂલ સમાજની દર્શિમાં કાયમની ભૂલ બની જાય છે.
- ૮) આચાર, લેખન, વાણી, વિચાર અને અનુભવ એ માનવની ઉત્તરોત્તર ચાડતી શ્રેણીઓ છે.
- ૯) મનને પ્રસંગ રાખવા માટે તમારા વિચારોમાંથી નકારાત્મક વલણા, નિરાશા અને વિધાદને તિલાંજલિ આપી દો.
- ૧૦) બિંદગી સાવ નાની છે, તોય બર્દલા મજાની છે, જો જીવતાં આવડે તો સારું, નહિંતર પરેશાની છે.
- ૧૧) જીવન કદી એકધારું નથી વહેંતું, કચારેક જો કોઈ સમર્થ્યા ઊભી થાય તો ચર્ચા કરીને તેનો ઉકેલ લાવવો જોઈએ.
- ૧૨) જે મન પર નિયંત્રણ રાખે તે જ આત્મકચ્યાણ સાધી શકે છે, હસી હસીને કરેલાં પાપનાં ફળ રડી રડીને ભોગવવાં પડશે.
- ૧૩) પૈસા ઘર સુધી સાથે રહેશે, કુટુંબીઓ સ્મશાન સુધી સાથે આવશે, જ્યારે ધર્મ તો પરભવમાં પણ તમારી સાથે આવશે.
- ૧૪) જગતભરના તમામ પૌદ્ગાલિક પદાર્થો મળવા સુલભ છે, પરંતુ વીતરાગનો ધર્મ મળવો અતિદૂર્લભ છે.
- ૧૫) આવેલાં દુઃખને મજેથી ભોગવવાથી ભગવાનની આજાનું પાલન થાય છે, તેથી પાપનું વિસર્જન, પુણ્યનો બંધ અને સુખનું સર્જન થાય છે.

- ૧૬) બિંદગીનો સૌથી મોટો કોથડો છે એકબીજાને સમજવાનો.
- ૧૭) જીવન ટકાવી રાખવા માટે ખાવાનું છે, સ્વાદ માટે નહિં, આ સૂર્ય હૃદયમાં કોતરી રાખવા જેવું છે.
- ૧૮) જેના દિલમાં શ્રદ્ધા નથી તે મોક્ષને પામી શકતો નથી, પરમાત્મા પ્રત્યે શ્રદ્ધા રખાય, શરત નહિં.
- ૧૯) હાર્દી ગયા પછી હારનો સ્વીકાર કરવો તે જુત છે, જુતી ગયા પછી જુતનો અહંકાર કરવો તે હાર છે.
- ૨૦) પ્રસંગચિત રહો અને અન્યને ઉપયોગી થવાનો સંકલ્પ કરો.
- ૨૧) સંસારીઓ દુઃખનો અંત શોધે છે, જ્યારે સંતો દુઃખનું કારણ શોધે છે.
- ૨૨) સંપ, સહકાર અને શ્રદ્ધા પ્રગતિનું કારણ બને છે.
- ૨૩) હૈયાના દા પર મલમપહો કરનાર બહુ અત્ય છે, હૈયાના દા પર નમક છાંટનાર બહુ વિશાળ છે.
- ૨૪) સંસારના સુખની ઈરછા જ જીવનને દુઃખી કરનારી છે, નિયમ વિનાનો માનવી, લગામ વિનાના દોડા જેવો છે.
- ૨૫) જીવનમાં સુખી થવું હોય તો મારે કંઈ જોઈતું નથી અને મારો કોઈ શશ્વત નથી, આ રટણ ચોવીસ કલાક કર્યા જ કરો.
- ૨૬) મોટી વાત તમારા જીવનમાં વરસો ઉમેરવાની નહીં, પણ તમારાં વરસોમાં જીવન ઉમેરવાની છે.
- ૨૭) પ્રશંસા માણસની ગેરહાજરીમાં થાય તો શોભે, નિંદા તો માણસની હાજરીમાં જ શોભે.
- ૨૮) જ્યારે બીજા માણસે અપેક્ષા પણ ન રાખી હોય ત્યારે તમે એને યશ આપો.
- ૨૯) સંતાનોના એમની રીતના સુખી જીવનનો માળો વિખરાય પણ નહીં એ જોવાની જવાબદારી ઘરના મોભી તરીકે આપણી છે.

ટછુકો

- ‘એક માણસ બે ભૂરી આંખોના પ્રેમમાં પડયો અને પછી આખા શરીરને પરણવાની ભૂલ કરી બેઠો.’
- આંસુઓના પડે પ્રતિબિંબ એવા દર્શા કર્યા છે ? કલ્યા વિના સદગું સમજે એવા સંગપણ કર્યા છે ?
- માણસ બધું સમજુ શકે છે, પરંતુ પોતાનો સ્વભાવ સમજુ શકતો નથી.
- માણસજાતને શું જોઈએ છે એ કદી સમજાયું નથી. એ પહેલા પ્રકાશ પ્રવેશી શકે એ માટે બારીઓ બનાવે છે અને પછી પ્રકાશને પ્રવેશતો અટકાવવા માટે પડા બનાવે છે.

વોટ્સઅપ પર અમારા
ડેવલપમેન્ટ મંગી શ્રી
અનિલભાઈ દોશીનો એક સુંદર
મેસેજ આવેલો - 'પ્રસંગને

મહેકી શકે છે આ જિંદગી

■ લિ. કિરણ શાહ (Past Chairman)

સાચવતા, માણસને સમજતા અને તકને ઝડપતા જે આવડી જાય તો સમજો કે, જિંદગી જુતી ગયા અને જુવી ગયા.' ટૂંકમાં માણવું એ જ જાણવું એ જ આપણો જીવનમંત્ર હોવો જોઈએ. ઘણાખરા માણસો બીજાઓને માટું લાગશે, લોકો શું કહેશે એવા વિચારો કર્યા કરીને જીવવામાં જ એની અડધી જિંદગી પસાર કરી નાખે છે. જિંદગી એક રમત છે, એ ખરેખર રમતાં-ગમતાં અને મરણને ગંભીર ગણ્યા વગર જીવવી જોઈએ. જીવનની કણાભંગુરતાનો જો એકવાર આપણે સ્વીકાર કરી લઈએ તો જલસો પડી જાય. શાસ જો દેછ ટકાવવામાં જ ખર્યાઈ જાય તો જિંદગી ઉજળવા માટે સિલક કેટલી બચે? ખુલ્લા મનથી જીવનનો સ્વીકાર કરવો જોઈએ. જે કંઈ કરવું તે પૂર્ણ મનથી કરવું. તમારી જિંદગી તમે જ જુવો, કારણકે તમારું મન પણ તમારું જ છે. માણસે વ્યસ્ત નહીં, પણ મસ્ત રહેવાની અપેક્ષા રાખવી જોઈએ અને તેવો પ્રયત્ન કરવો જોઈએ.

આખી જિંદગી આપણે સંજોગો અને લોકોને મેનેજ કરતા રહીએ છીએ, પણ આ કરવા માટે જરૂર પડે છે આપણી જાતને મેનેજ કરવાની. 'જોઈ લેવાની' અને 'બતાવી દેવાની' લહાયમાં આપણે જિંદગીનો કેટલો બધો અમૂલ્ય સમય ગુમાવતા હોઈએ છીએ. દુશ્મની કે વેરઝેર એ મોટે ભાગો તો આપણે ખેંચી રાખેલો ભૂતકાળ જ છે અને ઘણી વખત આપણો આપણા ભૂતકાળને એટલે ઓટી રાખીએ છીએ કે આપણાને વર્તમાન કે ભવિષ્ય નજરે પડતાં જ નથી. માણસ સારો દેખાવા જેટલો મથે છે એટલો સારો બનવા મથતો નથી. ફરિયાદ અને અફ્સોસમાં જ આપણે આપણી એનજી વેસ્ટ કરતા હોઈએ છીએ. આપણે જો ઘણુંબધું સારી રીતે જીવવું હોય તો આપણા મતે આપણી કઈ અપેક્ષાઓને જીવવા દેવી અને કોને મારી નાખવી તે નક્કી કરવા દેવું જોઈએ. મારા હિસાબે તો આપણે જિંદગીને કચારેક છૂટી મૂકી દેવી જોઈએ - જિંદગીના મોટા ભાગના સવાલોને જિંદગી પર જ છોડી દેવા જોઈએ. મોડે કે વહેલે જિંદગી એનો જવાબ આપતી જ હોય છે. આપણે ફક્ત એટલો ખચાલ રાખવો કે જીવનમાં સતત પરિવર્તનશીલ રહેવું અને પછેડી મુજબ જ

સોડ તાણાવી, તો જ સાચું જીવન માણી શકાશે. પછેડી પ્રમાણે જેને સોડ તાણાતાં આવડે છે એને કચારેય વાંધો આવતો નથી. એનું ગાડું ગબડતું જ રહે છે.

આપણે આપણી જિંદગી માટે કોઈ ધ્યેય રાખવાનું છે - કુછ પાના હૈ, કુછ કરકે દિખાના હૈ. આપણે સમજવાનું છે કે ડગુમગુ મનથી આગામ વધવું અશક્ય છે. જીવનમાં કચાંચ પણ પહોંચવું હોય, કશુંક ધારેલું પાર પાડવું હોય તો સૌથી પહેલા એ દિશામાં ચાલવા માટેનો સંકલ્પ કરવો પડે છે. After all journey of a thousand miles begins with a single step. પ્રારંભ પર આધાર રાખીને બેસી રહેનારા જીવનમાં કચાંચ પહોંચી શકતા નથી. પ્રારંભ અને પુરુષાર્થ અંગોની સદીઓથી ચાલતી આવતી ચર્ચાબાજુનો આખરી ઉકેલ હજુ આવ્યો નથી અને એટલા માટે જ '....તું ન લેજે વિસામો' ચલના જીવન કી કહાનીની ફિલોસોફી.

માનવ માટે જીવનની દરેક ક્ષણ ઈશ્વરની એક અનુપમ ભેટ છે. તત્ત્વજ્ઞાનીઓ કહે છે કે માણસે ભૂતકાળમાં આળોટવું ન જોઈએ. આજના માણસની હાલત એવી છે કે એની પાસે જરૂરિયાત પૂરતી બધી જ વસ્તુઓ હોવા છતાં બંન્ધ બેલેન્સ વધારવાની લહાયમાં એ પોતાનું બેલેન્સ ગુમાવી બેસે છે. જીવનનો ખાસ અર્થ છે તે આપણા કાર્યને સંબંધિત છે. આપણે એવી પ્રતિજ્ઞા લઈએ કે રોજ કોઈ એક સુકૃત્ય કરવું, જેથી એક સારું સ્મરણ દિવસભર રહે. એ શુભ કાર્યના પુણ્યથી આખો દિવસ સારો જશે, કારણકે તેના માથે સુકૃત્યનો ચાંદલો લાગ્યો છે.

પ્રસિદ્ધ અભિનેતા ચાર્લિં ચેપ્લિને કહ્યું છે કે, Life laughs at you when you are unhappy, Life smile at you when you are happy but life salutes you when you make other happy. આ કારણે આપણે વાણી, વર્તન અને કર્મ એવાં રાખીએ કે સર્વ દિશાઓમાંથી શુભ ભાવનાઓનો પ્રવાહ અવિરત આપણા તરફ વહેતો રહે. આજના દિવસે આપણે નક્કી કરીએ કે આપણી બાકીની જિંદગી આપણે સુકૃત્ય કાર્યો સાથે જુવીએ, સંગીત સાથે જુવીએ, પુસ્તક સાથે જુવીએ, સાચા મિત્રો સાથે જુવીએ, પોતાના સાથે જુવીએ-માત્ર જીવવું એ જ ઐશ્વર્ય અને તો જ 'મહેકી શકે છે આ જિંદગી'.

ગૃહ મૈષ રાશિ:

ઓળખ : જાડી-ટૂકી ગરદન, એકવડો મજબૂત બાંધો, ટળતું કપાણ, વાંકળિયા વાળ, ભૂખરી કાળી ગોળ આંખો, વેધક નજર, મોટા દાંતો, મોટું નાક, માથા કે કપાણ પર ડાધ-દા (કયારેક સ્થૂળ-ભરાવદાર શરીર), ચાલવા અને બોલવામાં ઝડપી હોય છે.

(લગુનમાં રહેલ શ્રદ્ધા કે લગુનમાં દર્શિ કરતાં ગ્રહની અસર પડે છે). હાથમાં ગુરુ તથા મંગળના પહાડો વિકસેલ હોય છે.

સ્વભાવ : આવી વ્યક્તિ સ્પષ્ટવકતા, સ્કૂર્ટિલા, સાહસિક, હિંમતવાન, સંગીતપ્રેમી, વિચારોમાં મક્કમ, નિખાલસ, બુદ્ધિશાળી, આધુનિક વિચારસરણીવાળા, નોંધપાત્ર આભિશક્તિ, કુટુંબપ્રેમ, આતિથ્ય સંકાર કરનાર, સંબંધીઓ-મિત્રોને ખવડાવવામાં રાજુ થનાર હોય છે. મિત્રોમાં આવકાર પામનાર, મહેનતુ.

મર્યાદાઓ: (૧) ભૂલો કાટવાની ટેવ ઘટાડવી (૨) આંધળું અનુકરણ કરો નહિ (૩) બોલવા પર નિયંત્રણ જરૂરી (૪) જીવનમાં લાગણી વ્યક્ત કરી શકતા નથી, પરિણામે પ્રક્ષો સર્જય છે (૫) ઉતાવળ-કોધ ઘટાડવો (૬) ઊંચા સ્વરે બોલી કે સ્પષ્ટ વ્યક્તત્વથી હિતશ્રૂષો ઊભો કરો નહિ (૭) આપનો અહ્મ ટકરાય નહિ તે જોશો. બીજાઓને અનુરૂપ થાવ, નમતું જોખતા શીખો. મોટું મન રાખી બાંધછોડ કરશો (૮) બંધિયાર વાતાવરણમાંથી બહાર ફરવાનું અચૂક રાખશો. જીવનસાથી સાથે અઠવાડિયામાં એક-બે વાર બહાર નીકળી, હસીખુશી-આનંદ મેળવશો (૯) માનસિક વ્યગતા-ટેન્શન દૂર કરવા, સમયનો ખચાલ રાખી, ગણતરીપૂર્વકનું આયોજન કરશો (૧૦) નાની નાની બાબતો માટે મગજ ગુમાવો નહિ (૧૧) ઓફિસ, વેપાર-ઉદ્યોગ-વ્યવસાયનું વાતાવરણ ઘરે લાવો નહિ. પલ્લી-બાળકો માટે સમય ફરખવશો (૧૨) જીવનસાથીને શોખ બિનજ પ્રકારના હોય, આત્મીયતા ઓછી હોય છે. એકબીજાને અનુરૂપ થવા પ્રયત્ન કરવા (૧૩) નોકરી કરતાં હોય તો શેડ સાથે, ઉપરી અધિકારી સાથે તડકડ કરશો નહિ (૧૪) પિતા સાથે વિચારભિક્ષતા હોય, મનમેળ ઓછો હોય, પિતાના દંધામાં ફ્રાવટ ન આવે (૧૫) શોર-સહૃદ્ય-જુગારમાંથી આકસ્મિક ધનલાભ ખાસ મળશે નહિ.

રાણીયક

■ ડૉ. ચંદ્રકાંત મોહનલાલ પાટક

(૧૬) જીવનસાથી સાથે કામજીવનથી આકર્ષણ-લાગણી રહે. વિચાર સરળીમાં ભિક્ષતા રહે.

શક્ય દર્દ: હરસ, મરસા, માથાનો

દુઃખાવો, જાતીય દર્દ, ગ્રૂમદાં, ફોલ્લા, પેટનાં દર્દ, ચામડીનાં દર્દ, ખીલ, કમળો, પથરી, બ્લડપ્રેસર, અનિદ્રા, માથા પર વાગાંબું, ટાલ પડવી, ઈજા થવી ગણાવી શકાય. સામાન્ય રીતે ઉંમર વર્ષ ૧૬, ૨૦, ૨૮ ૩૪, ૪૧, ૫૧ની ઉંમરે ધનસુખ-ભાગયવૃદ્ધિ થાય, વાહનસુખ-સમૃદ્ધિ, શુભ ફળ મળે છે. જ્યારે ઉંમર વર્ષ, ૬, ૮, ૧૫, ૩૬, ૪૦, ૪૫, ૫૬, દુટમાં બીમારીની શક્યતા રહે અથવા ધનહાનિ થવા સંભવ.

શક્ય વ્યવસાય : એન્જિનિયર્સ, ધાતુશાસ્ત્રી, ડોક્ટર, ફોરેસ્ટ એંડિસર.

ગૃહ વૃષભ રાશિ:

ઓળખ : આ જાતક ઢીંગાણા, ગરદન ટૂકી-જાડી, સપ્રમાણ મધ્યમ બાંધો, ભરાવદાર આકર્ષક ચહેરો, પહોળા મજબૂત ખભા, મારકણી આંખો, જાડાં ભવાં, ખલેથી નમી ચાલનાર, ઘઉંવણી, કાબરી આંખ, મધ્યમ વયે જાડા હોય છે. સ્ત્રી જાતક ખૂબ જ સુંદર હોય છે. યૌવનની જાળવણી કરનાર હોય. ઉંમર કળી શકતી નથી. તર્જનીની આંગળીનો છેલ્લો વેટો મોટો હોય છે.

સ્વભાવ: કોઠાસૂઝ સારી ધરાવનાર, મિલનસાર, લાગણીશીલ, પ્રભાવશાળી, વ્યવસ્થાપક, મહિલાકાંક્ષી, કાર્યકુશળ, સમજુ, વિશાળ મિત્રમંડળવાળા, વ્યવહારુ, સંગીતપ્રેમી, કલારસિક, મનમોજુ-મસ્તરામ, ખાવા-પીવાના શોખીન, શાંતિપ્રિય, સારી હૈયાઉંકલતવાળા, હોશિયાર, બુદ્ધિશાળી, ઘરની સજાવટમાં રસ લેનાર હોય છે. લોકોને મજા-આનંદ-સુખ આપવા પ્રયત્ન કરે છે. પાડોશી માટે ઘસાઈ છૂટે છે, પરંતુ ચશ મળતો નથી. લાંબું આચુષ્ય ધરાવે છે. જીવનમાં સારા મિત્રો સાંપદે છે, પરંતુ તેઓ સાથે ફાવતું નથી. ભણતર કરતાં ગણતર વિશેષ, ધાર્મિક વલણ અપનાવે છે. ગાયા જન્મના પુણ્યથી ધન, કુટુંબ, સારાં સંતાન સાંપદે છે. જગ્યા, જમીન, સરકારી બોંડ, બેંકમાં ડિપોઝિટ, ડિબેન્ચરમાં મૂડીરોકાણ કરશો. મહેનતથી આગળ આવનાર તેમ જ જન્મસ્થાનથી દૂર ભાગ્ય વિકસાવનાર હોય છે, ભાગીદારો સારા સાંપદે. ગાયા જન્મનું પુણ્ય સારું.

મર્યાદાઓ : (૧) સૌંદર્યપ્રસાધનોનો વધુપડતો ઉપયોગ ઘટાડવો, ટાપટીપ ઓછી કરવી (૨) પ્રશંસાની ભૂખ ઓછી કરવી (૩) જીવનસાથીને સંભળાવવાની આદત છોડવી (૪) સંતાનોના વિકાસ માટે સમય કાટવો (૫) જુગારનો શોખ કે વ્યસન ન થાય તેની કાળજી લેવી (૬) વાદ-વિવાદ કરી દુઃખી થશો નહિં (૭) જીવનસાથી માટેની અપેક્ષાઓ વધુ ન રાખો, લગ્નજીવન માણાતા શીખો (૮) આપનો હાથ છૂટો હોઈ હિસાબ લખશો. જીવનમાં કરકસર અપનાવશો, બચત કરશો (૯) દેખાડો કરવા ખોટા ખર્ચ કરો નહિં. શક્તિ બહારનું સાહસ-ખર્ચ કરો નહિં (૧૦) સગાં-સંબંધી-મિત્રો માટે કરજ કરવા હાથ લંબાવશો નહિં (૧૧) પૈસાનું મહત્વ સમજશો. ખર્ચાળ મિત્રો કે મતલબી મિત્રવર્તુળ ઓછું કરશો (૧૨) જીવનના અંતે કંઈક રહી ગયું-ખૂટે તેવો વસવસો કરવો નહિં.

શક્ય દર્દ : પેટનાં દર્દ, ડાયાબિટીસ વગેરે થવાની શક્યતા, ખાસ રોગ થતા નથી.

શક્ય વ્યવસાય : મહેનતના-મજૂરીપ્રધાન ધંધાઓ, લોખંડ, ખનિજ, વકીલાત, ડોક્ટર, ફિલ્મી કલાકાર, મશીનરીના ઉત્પાદક-વિકેતા.



મિથ્યુન રાશિ:

ઓળખ : એકવડો ઠિંચો શરીરનો બાંધો, લંબગોળ ભરાવદાર ચહેરો, લાંબું નાક, માયું મોઢું-શરીર નાનું (દેવ આનંદ જેવું), કપાળ વિશાળ, ઝડપી ચાલ, લાંબા હાથ, વેધક દસ્તિ, સ્કુર્ટિલા, બેઠેલી હંપચી, સુંદર ચહેરો, પગ ટૂંકા અને જાડા, આંખ ચક્કરભર્મર ફરતી હોય, બુધની આંગણી સૂર્યની આંગણીના પહેલા વેઠા કરતાં મોટી હોય છે.

સ્વભાવ : મિથ્યુન લગુનના જાતકો હોશિયાર, દયાળુ, માયાળુ, વિનયી, સમજુ, સારી યાદદાસ્તવાળા, બુદ્ધિશાળી, મહેનતુ, કાર્યકુશળ, સ્કુર્ટિલા, સ્વચ્છતાપ્રેમી, સાત્ત્વિક, લખાણ-વાંચનના શોખીન, સમયને અનુરૂપ વર્તન કરનાર, સારી આવકત, સંગીતપ્રેમી, ડહાપણાથી કામ કરનાર, નોંધપાત્ર ગ્રહણશક્તિ ધરાવનાર, જ્યોતિષમાં સારો રસ ધરાવે છે. ખાવા-પીવાના શોખીન, કોમ્યુટર બેઇન-ફોન પર વાતચીતથી ધંધો કરી શકે છે. ઝડપા પસંદ નથી. આવક સારી, પરંતુ બચત ઓછી કરે. બીજાનું ભલું કરવાનો અભરખો ધરાવે છે. જીવન માણી લેવામાં

માનતા હોય છે. સાચું બોલવાની ટેવ હોય કે સારી વાતને ટેકો આપે છે. પિતાની ખ્યાતિ સારી હોય છે. પિતા માટે સારું માન ધરાવે છે. વિચારો ઘણા કરે.

મર્યાદાઓ : (૧) ઉતાવળ ઓછી કરવી (૨) રોકાણાની રકમ સલવાઈ ન જાય તેનું ધ્યાન રાખશો (૩) તેઓનું મન કળી શકતું નથી (૪) ખોટો દેખાડો કરવો નહિં. બડાઈ ઓછી કરવી (૫) જીવનસાથી માટે પ્રેમ વ્યક્ત કરી શકતા નથી (૬) દલાલીથી ધન મળે, ધન કમાય છે, પરંતુ તેની વ્યવસ્થામાં ખામી રહે (૭) બીજાઓની મુશ્કેલીઓ દૂર કરી શકે, પરંતુ પોતાના પ્રશ્નોનું નિરાકરણ કરી શકતા નથી (૮) દેખાદેખીથી ખર્ચ કરો નહિં. પૈસાની બચત કરવાની ટેવ પાડો (૯) કરજ કરીને મોજમજા કરો નહિં. મિત્રો દ્વારા વ્યસન ન થાય તે જોશો (૧૦) હૃદયની ભાષા દ્વારા પ્રેમ વ્યક્ત કરી શકતા નથી (૧૧) મિત્રોની આગતા-સ્વાગતા કરો, પરંતુ મિત્રોને પૈસા આપવા નહિં. પાછા આવશે નહિં. શનિ બચત થવા ન હે. પૈસા આવે ને જાય. કરજ કરવું નહિં (૧૨) આવકનો અંદાજ રાખી, ખર્ચાળોનું આયોજન કરો. આકસ્મિક ખર્ચ ધ્યાનમાં રાખો. કયા ખર્ચાળીની કાપકૂપ કરી શકાય છે તે જાણો. બજેટ કરી બચત કરતાં શીખો (૧૩) વિચારો વધુ છે, પરંતુ અમલીકરણમાં આગસુ છો. જેટલા વિચારો અમલમાં મૂકી શકાય તેટલા જ વિચારો, ત્યાર બાદ બીજુ યોજના કરો (૧૪) શારીરિક શ્રમી દૂર ભાગો નહિં. મહેનત, કસરત, આસન, એરોબિક, ચાલવાનું વગેરે કરી શરીર તંદુરસ્ત રાખો. પેટનાં દર્દો થાય નહિં તે જોશો (૧૫) આપનાં વર્તન, વાણી, વ્યવહાર સુંદર કરશો, જેથી આપની છાપ સારી પડે (૧૬) જીવનમાં સફળ બનવા માટે ટીકાતમક વલણ છોડશો. વારંવાર લોકોને વણમાગી સલાહ આપો નહિં. બીજાઓને ધ્યાનથી સાંભળો. જમીન-મિલકતથી લહેણાદેવી ઓછી રહે. લોટરી કે આકસ્મિક લાભની શક્યતા ઓછી રહે.

શક્ય દર્દ : શરદી, ટૂંકી માંદગી અવારનવાર આવતી રહે. આયુષ્ય દ૫-૭૦ વર્ષ આસપાસ (બહારનું તેલવાળું ન ખાવું).

શક્ય વ્યવસાય : કોમ્યુટર, હિસાબનીશ, વકીલ, પ્રોફેસર, સેલ્સમેન, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, દલાલી, એજન્સીનું કામ, પ્રોફેસર, બુધ પ્રકારના વ્યવસાયો.

ધર્મ કા અર્થ મહાપુરુષો કી વાણી સે

■ અનોખીલાલ ધોકા (જૈન) જેજેસી-અંકલેશ્વર

પુરાને જમાને કી બાત હૈ। એક ગાંવ મેં એક રાજા રહતા થા। અચ્છી વસ્તી થી। જૈન સમાજ કે તીન સૌ ઘર થે। ઉસી ગાંવ મેં એક જૈન મન્દિર થા, જો વહાઁ કે નગર શેઠ ને બનવાયા થા। ગાંવ કે લોગ રોજ સુબહ મન્દિર મેં ભગવાન કે દર્શન હેતુ જાયા કરતે થે। કોઈ સેવા-પૂજા કરતા, કુછ લોગ આરતી ઉતારતે, માલા જપતે, સામાયિક આદિ કિયા કરતે એવં અપને આપકો ધન્ય માનતે। ધર્મસ્થાન પર જાનેવાલા વ્યક્તિ અપને આપ કો ધર્મિષ્ટ સમજીતા હૈ। કિસી કો કોઈ સ્તવન વગેરહ ગાના આતા હો યા કોઈ ધાર્મિક અનુષ્ઠાન કરના જાનતા હો, યા ભગવાન કી પૂજા કરના જાનતા હો, દાન આદિ દેતા હો, એસે લોગ સમાજ મેં અપને આપકો બહુત ઊંચાઈ પર દેખતે હૈને। કિન્તુ ક્યા ધર્મ કી પરિભાષા યહી હૈ, સામાયિક કરના, સેવા-પૂજા કરના, પ્રવચન સુનના, રોજ સુબહ ઉઠકર મન્દિર દર્શન હેતુ જાના, સ્તવન આદિ ગાના, દાન દેના, તપ કરના યે સારે અનુષ્ઠાન ધર્મ મેં નિહિત હૈને, પરન્તુ ઇતના સબ કરનેવાલે વ્યક્તિ હી ધર્મ સે જુડે હૈને। અન્ય નહીં? ક્યા ધર્મ કા અર્થ યહી હૈ? આઇયે ઇસ કહાની કે માધ્યમ સે દેખતે હૈને, ધર્મ ક્યા હૈ?

ઇસ ગાંવ કે ગાંવનાલે સભી સુબહ મેં મન્દિર જાતે હૈને। આરાધના કરતે હૈ। એવં ફિર ધંધે-ચ્યાપાર હેતુ અપની અપની દુકાન પર ચલે જાતે હૈ। એક સમય કી બાત હૈ। મન્દિર મેં દેવોને ને ચમત્કાર કિયા ઔર વહાઁ સોને કી એક થાલી રખ દી। જો ભી વ્યક્તિ મન્દિર મેં આતા ઉસે વહ થાલી દિખતી। જૈસે હી વ્યક્તિ ઉસકે નજરીક પહુંચતા આકાશવાણી હોતી; અગર આપ ધર્મિષ્ટ વ્યક્તિ હો તો હી ઇસ થાલી કો છુયો। અન્યથા યહ થાલી અધર્મી વ્યક્તિ કે છૂને સે લોહે કી બન જાયેગી।

અબ મન્દિર મેં જાનેવાલા હર વ્યક્તિ અપને આપકો ધર્મિષ્ટ માનતા હૈ। અધર્મી નહીં માનતા। સર્વ પ્રથમ પૂજારી ને મંદિર કા દરવાજા ખોલા। ભગવાન કે દર્શન કિયે ઔર રોજ કી તરહ મન્દિર કી સફાઈ એવં પૂજા કા કાર્ય શરૂ કિયા વહાઁ ઉસે સોને કી થાલી દિખાઈ દી। પૂજારી ને મન હી મન સોચા, અરે સબસે જ્યાદા ધર્મ મૈં હી કરતા હું। મૈં અધિક સમય ભગવાન કે પાસ યાને મન્દિર મૈં હી રહતા હું। મુઝસે જ્યાદા ધર્માત્મા કોઈ હો હી નહીં સકતા, કિન્તુ જૈસે હી વહ થાલી કો છૂતા હૈ કી તુરન્ત થાલી લોહે કી બનકર નીચે ગિર જાતી હૈ। પૂજારી ઉદાસ હો ગયા એવમ મન્દિર મેં

એક તરફ ખડા હો જાતા હૈ। થાલી પુનઃ સોને કી હો જાતી હૈ। તભી વહાઁ નગરશેઠ આતે હૈને। ઉન્હોને ભગવાન કે દર્શન કિયે એવં સ્તવન આદિ બોલને લગે, તભી ઉની નજર

ઉસ સોને કી થાલી પર ગિરી। નગરશેઠ પૂજારી કો દેખતે હૈને। પૂજારી ને સારી હકીકત બતાઇ। નગરશેઠ સોચને લગે: મેરે સે જ્યાદા ધર્માત્મા કૌન હૈ। યહ સોચકર થાલી કો હાથ લગાતે હૈને। જૈસે હી નગરશેઠ થાલી કો છૂતે હૈને। થાલી લોહે કી બન જાતી હૈને। નગરશેઠ ઉદાસ હો જાતે હૈને ઔર ચિંતન કરતે હૈને। ઉસી સમય વહાઁ રાજા મન્દિર મેં ભગવાન કે દર્શન હેતુ પદ્ધારતે હૈને। પુનઃ થાલી સોને કી હો જાતી હૈ। રાજા નગરશેઠ એવં પૂજારી કો ઉદાસ દેખતે હૈને। તભી નગરશેઠ સારા હાલ રાજા કો સુનાતે હૈને। રાજા સોચને લગે, મુઝ સે જ્યાદા ધર્માત્મા કૌન હો સકતા હૈ। મૈં પ્રજા કે લિયે હી જીતા હું। પ્રજા કે લિયે હી મરતા હું। કભી કિસી કો કષ્ટ નહીં પહુંચાતા હું। એસા સોચકર જૈસે હી રાજા થાલી કો હાથ લગાતે હૈને। સોને કી થાલી લોહે કી બન જાતી હૈને।

અબ મન્દિર મેં મંત્રી પહુંચતે હૈને। દર્શન આદિ વિધિ કરતે હૈને। ઇતને મેં થાલી પુનઃ સોને કી બન જાતી હૈ। મંત્રી, રાજા, નગરશેઠ એવં પૂજારી ઉદાસ દિખાઈ દેતે હૈને। રાજા ને સારા હાલ સુનાયા। મંત્રી સોચને લગા, મુઝમેં ક્યા કમી હૈ। મૈં રાજા કો સહી સલાહ દેતા હું। પ્રજાહિત કાર્ય કરતા હું। મુઝસે જ્યાદા ધર્માત્મા કોઈ હો હી નહીં સકતા। જૈસે હી મંત્રી થાલી કો છૂતા હૈ, થાલી લોહે કી હો જાતી હૈ। અબ મંત્રી વિચાર કરતા હૈ, સચ્ચા ધર્માત્મા કૌન? યહ બાત ધીરે-ધીરે પૂરે ગાંવ મૈં ફૈલ જાતી હૈ। રાજા શર્મસાર હો કર રાજમહલ મેં ચલા જાતા હૈ। જિજાસા કે સાથ ગાંવ કે સભી લોગ બારી-બારી આતે હૈને। થાલી કો છૂતે હૈને। કિન્તુ જૈસે હી વ્યક્તિ થાલી છૂતા હૈ, થાલી લોહે કી બન જાતી હૈ। આસપાસ કે ગાંવો મેં બી બાત ફૈલ જાતી હૈ।

એક-એક કરકે લોગ આને લગે। કૌતૂહલ કે સાથ લોગ આતે એવં નિરાશા હોકર વાપસ ચલે જાતે। સાધુ મહાત્મા આયે, જ્ઞાની આયે, દિન ભર માલા જપનેવાલે આયે, કઈ પ્રકાર કે લોગ ઉસ મન્દિર મેં આતે હૈને। કિન્તુ આગન્તુક મેં સે કોઈ ધર્માત્મા નહિ દિખા, જો ભી થાલી કો છૂતા થાલી લોહે કી બન જાતી। યહ કાર્ય ચાર દિન ચલા પર કિસી કો સફલતા નહીં મિલી। અબ વહાઁ મન્દિર મેં બહુત સે લોગ ઇક્કટે હો ગયે થે। સભી જાનના

ચાહતે થે। ધર્મ ક્યા હૈ, ઔર ધર્માત્મા કૌન હૈ?

પાસ કે ગાંબ મેં રહનેવાળા એક કિસાન નન્દલાલ ઉસકા નામ। વહ ઉસી ગાંબ મેં ઘર કે સામાન કી ખરીદી હેતુ વહાઁ પહુંચા। વહ પહેલે મન્દિર મેં આયા, ભગવાન કે દર્શન કિયે। નવકાર મંત્ર કી માલા ફેરી। ફિર મન્દિર કે બાહ્ર ઓટલે પર બૈઠ ગયા। ઉસ જમાને મેં લોગ પૈદલ ચલતે થે। ગ્રાતાયાત કે સાધન કમ થે। ૧-૨ ટાઈમ કા ખાના સાથ રહતે થે। નન્દલાલ કો ભૂખ લગી થી। પોટલી ખોલકર ખાને બૈઠા। રોટી ઔર મિર્ચી સાથ મેં લાયા થા। તથી ઉસકી નજર સામને ઓટલે પર બૈઠે વ્યક્તિ પર પડી। વહ બીમાર થા। એવં દર્દ કે મારે કરાહ રહા થા। ઉસકે શરીર મેં બડે-બડે ફોડે થે। ઉસમેં સે રક્ત એવં પસ બહ રહા થા। નન્દલાલ દૌડા ઔર ઉસ દર્દી કે પાસ પહુંચ ગયા। અપને સિર પર જો એધારી બાંધ રહી થી। ઉસમેં સે કુછ દુક્કે ઉસને નિકાલે ઔર ઉસ બીમાર વ્યક્તિ કે ફોડો મેં સે દ્વા-દ્વા કર ઉસને સારા મવાદ નિકાલ દિયા। બીમાર વ્યક્તિ કરાહ રહા થા। ઉસે પ્યાસ લગી થી। ઉસને નન્દલાલ સે કહાઁ, મુઝે પાની પિના હૈ। કિસાન પાસ કે એક ઘર મેં જાકર પાની લાતા હૈ। એવં ઉસ દુઃખીયારે કો પાની પિલાતા હૈ, પાની પિને કે બાદ ઉસને પુનઃ નન્દલાલ સે કહા, મૈં ૩ દિન સે ભૂખા હું, મુઝે કુછ ખાને કો મિલ જાય તો કૃપા હોગી।

કિસાન સોચ રહા થા। યહ વ્યક્તિ બહુત દુઃખી હૈ, ઔર ભૂખા ભી હૈ। તુરન્ત વહ મન્દિર કે ઓટલે પર રહા ઉસકા ખાના ઉસ બીમાર વ્યક્તિ કો દે દેતા હૈ। ઉસને વિચાર કિયા, ઇસકી આત્મા કો શાન્તિ પહુંચેગી। મૈને તો કલ શામ કો ખાના ખાયા હી થા, ઔર વાપસ આજ શામ ઘર જાકર ખાના ખા હી લુંગા। મુઝે કુછ ભી ફર્ક પડતા નહીં હૈ। ઇસ તરહ નન્દલાલ ને ઉસ ભિખારી કી સેવા કી ઔર સચ્ચે મન કે ભાવ સે ઉસકા કાર્ય કિયા। ઇસ કાર્ય મેં ઉસે કિસી પ્રકાર કા લોભ નહીં થા। બસ દર્દી કે હૃદય સેં દુઆ નિકલી એવં વહ દુઆ નન્દલાલ કી આત્મા કો સર્શ કર ગયી। અગર આપકી તિજોરી ખાલી હોગી તો ચલેગા, કિન્તુ દિન-દુખિયાં કી દુઆઓં સે દિલ ભરા રહના ચાહિયે।

અબ પુનઃ નન્દલાલ એક બાર મન્દિર મેં જાતા હૈ ઔર ભગવાન કે દર્શન કર કે અપના કાર્ય શીગ્ર નિપટાકર ઘર જાને કી સોચતા હૈ। મન્દિર મેં પહુંચતે હી, ઉસે લોગ કહને લગે, ભાઈ તૂ ઇસ થાલી કો છૂ લે, તબ વહ દિલ કે નિખાલિસ ભાવ સે

કહતા હૈ, મૈં ભગવાન કે દર્શન કરને આયા હું, મુઝે થાલી સે કુછ લેના-દેના નહીં હૈ, લોગો કા આગ્રહ ઉસે થાલી કો છુને કે લિયે મજબૂર કરતા હૈ। નન્દલાલ થાલી કો છૂતા હૈ, થાલી સોને કી હી રહતી હૈ, સભી લોગ ઉસ ધર્માત્મા કે દર્શન કરતે હૈ। ભાવવિભોર હો જાતે હૈ। ઉસે થાલી સાથ લે જાને કે લિયે કહતે હૈ ઔર કહતે હૈ કિ યહ થાલી આપકે કિસ્મત કી હૈ, ઔર સારી ઘટના સમજાતે હૈનું। કિસાન થાલી લે જાને કે લિયે મના કરતા હૈ। કહતા હૈ, “મુઝે ઇસકી જરૂરત નહીં હૈ, મૈં અપને કાર્ય મેં મસ્ત હું”।

જ્ઞાની યહી કહતે હૈનું। જન્મ, જીવન, એવં મૃત્યુ કા મર્મ સમજાયે ઉસે ધર્મ કહતે હૈ”। જીવન કો જીને લાયક બનાયે, જીવન મેં સુખ, માનવતા ઔર સમજાશક્તિ કી સુગંધ લાયે ઉસે ધર્મ કહતે હૈનું। સાંસારિક જિમ્મેદારિયોં સન્તોષકારક તરીકે સે નિભાને કા સન્તોષ ઉસે ધર્મ કહતે હૈનું। ધર્મ મેં ધર્માન્ધિતા ન મિલે, ઉસકી સતર્કતા રહે ઉસે ધર્મ કહા જાતા હૈ, અપને વિચારો કો ઊંચી કક્ષા પર રહુને કા પ્રયત્ન ઉસે ધર્મ કહા જાતા હૈ। ખુદ કે અલાગ ઔરોં કે લિયે કુછ કર ગુજરને કી ભાવના ઉસે ધર્મ કહતે હૈ। દૂસરોં કે દુઃખોં મેં સાજીદાર બનને કી આત્મીયતા કો હી ધર્મ કહા જાતા હૈ।

ધર્મ આત્મા કે કલ્યાણ કે લિયે હૈ, ન કિ શરીર કે કલ્યાણ કે લિયે। ધર્મ કા સ્થાન મન્દિર, મસ્જિદ યા મૂર્તિયોં મેં ન હોકર, અપને ઉચ્ચ વિચારોં મેં હોતા હૈ। મન્દિર, મસ્જિદ એવં મૂર્તિયા નાશવાન હૈનું। પરન્તુ અપને વિચારોં મેં બસે ધર્મ કા કોઈ ભી નાશ નહીં કર સકતા।

સચ્ચે ધર્મ કી પરખ કે લિયે ઉચ્ચ પ્રકાર કા પઠન, જ્ઞાની વ્યક્તિયોં કા સંત્સંગ, સાથ હી ખુદ કે ઊંચે વિચારોં કા હોના જરૂરી હૈ। ધર્મ કા સચ્ચા સ્વરૂપ જાનને કે બાદ અપને આપ મેં બાહી દિખાવે કા કોઈ સ્થાન નહીં રહતા હૈ। સચ્ચે ધર્મ કે આચરણ સે એક ખાસ પ્રકાર કે આંતરિક સન્તોષ કી પ્રાપ્તિ હોતી હૈ, જો જીવન પર્યન્ત ટિકી રહતી હૈ।

વો લમ્ફા જિન્ડગીભર - ખુદ કી ઇવાદત સે જ્યાદા પ્યારા હૈ જો એક ઇન્સાન ને દૂસરે દુઃખી ઇન્સાન કી ખીદમત મેં ગુજારા હૈ

પૌંછ લો આઁસુ દુઃખી કે ઔર દુઃખો કો બાંટ લો
મૂલ મંત્ર યહી હૈ જિન્ડગી કા, કિ પ્યાર દો ઔર પ્યાર લો

BIO DATA



Name : Dr. KOMAL HITEN SHAH
Bd/Bp/Bt : 14-9-1990 / Ahmedabad / 9.07 a.m.
Height : 5' 2"
Degree : PHYSIOTHERAPIST , B.P.Th, M.I.A.P
Religion : Jain – Deravasi (Murtipujak)
Caste : Shree Dasha Shreemali Betalis Jain
Address : 1/33 Laxmi Estate Society, Varma Nagar,
Old Nagardas Road, Andheri (East),
Mumbai – 400069, India
Telephone-R : 022-2683 3777
Mobile : 9821018579 (Hiten)9757267945(Jyoti)
Email : hitenks63@gmail.com
Education : Bachelor of Physiotherapy from M.G.M.
School of Physiotherapy , Stood 3th in
the final year, has done several Projects
and papers submitted.
Work Exp. : Working as Physiotherapist from the
Last one year, also working at Dr. Atul
Londhe's Clinic.


FAMILY DETAILS :

Father : Hiten Kantilal Shah, (B.Com, D.B.M)
Mother : Jyoti Hiten Shah (B.A)
Sister : Sheetal Hiten Shah (4th Year B.P.Th.)
Brother : Jainam Hiten Shah (Xth)
Gr. Father : Late Kantilal Manilal Shah (B.Pharm)
Gr. Mother : Subhadra Kantilal Shah
Native : Mudarda, Near Mehsana, Gujrat
Mosal : Jayantilal Gandalal Shah (Titoda)

FURTHER INFORMATION :

Motapapa : Jayesh Kantilal Shah – Pathological
Laboratory
Kaka : Snehal Kantilal Shah – Director-Fisher
Rosemount
Mama : Kamlesh Jayantilal Shah – Ahmedabad
Rajesh Jayantilal Shah – Ahmedabad
Masi : Mita Hitendra Shah (Maknaj) –
Vile Parle (W)
Bhavna Ragesh Shah (Balva) -
Ahmedabad
ADVT.

BIO DATA



Name : Dr. MANSI HITENDRA SHAH
Degree : PHYSIOTHERAPIST , B.P.Th, M.I.A.P
Bd/Bp/Bt : 11-11-1990 / Ahmedabad / 2.56 p.m.
Height : 5'-10" feet
Religion : Jain – Deravasi (Murtipujak)
Caste : Dasa Shreemali Betalis Jain
Address : 301, Rashmi Kunj, Plot. No. 26,
Navyug Society, Opp. Sun Flower
Hospital, Juhu Scheme, V.M. Road,
Vile Parle (West), Mumbai – 400056.
Mobile : 9757112199 (Mita)
8080727981 (Hitendra)
Email : mansi4190@gmail.com /
hitenks63@gmail.com

PERSONAL INFORMATION :

Father : Hitendra Babubhai Shah (B.Sc.)
Mother : Mita Hitendra Shah (M.A.)
Sister : Eshani Hitendra Shah (4TH Yr. B.D.S.)
Sister : Ashna Hitendra Shah (Final C.A.)
Gr. Father : Babubhai Jethalal Shah
President-Dasa Shrimali Betalis Jain
Gr. Mother : Sumitraben Babubhai Shah
Native : Maknaj, Nr. Mehsana, Gujrat
Mosal : Jayantilal Gandalal Shah (Titoda)
Education : Bachelor of Physiotherapy from M.G.M.
School of Physiotherapy
Work Exp. : Doing Private Visits, Working with
Sunridge Hospital, Working as
Physiotherapist from the Last one year,
also working at Dr. Atul Londhe's Clinic

FURTHER INFORMATION :

Motapapa : Jatin Babubhai Shah
Kaka : Manish Babubhai Shah
Mama : Kamlesh Jayantilal Shah
Rajesh Jayantilal Shah, Ahmedabad
Masi : Jyoti Hiten Shah (Mudarda)-Andheri(E)
Bhavna Ragesh Shah (Balva)-Ahmedabad
ADVT.

BIO DATA



Name : RACHIT HARESH SHAH
Bd/Bp/Bt : 20-4-1987 / Matunga-Mumbai / 03:50 am
Height : 5'-7" * **Weight** : 72 kg
Education : Master of Science (MS) in Electrical and Computer Engg.
 Georgia Institute of Technology-USA
 Bachelor of Engg (BE) in Electronics Engg.
 D. J. Sanghvi College of Engg,
 Vile Parle (W), Mumbai.
Work : Intel Corp. in Santa Clara, California (Silicon Valley) - 3.5 years
Religion : Vishashrimali Derawasi Jain, Ghoghari
Father : Haresh Chimanlal Shah (+91-9821063600)
 rachitent@hotmail.com
 Mfrs. of Flocks (Velvet Powder);
 Factory at Dahanu Road.
Mother : Priti H. Shah (+91-9819733544)
Sibling : Prachi Jimit Mehta (Married, Resides in Ghatkopar, Mumbai)
Dadaji : Chimanlal Jagjivandas Shah, Dahanu Road
Nanaji : Pravinchandra Dayalal Parekh, D/1302,
 Krushal Towers, Chembur, Mumbai
Native : Talaja, Dist. Bhavnagar
Address : 702, Legacy, 17, Dadabhai Road,
 Near Bhavan's College, Andheri (W),
 Mumbai - 400 058.
Phone : (+91-22) 26287733 / 34

ADVT.

BIO DATA



Name : NEMISH VINOD VORA
 (Visiting India Nov. End 2014)
Bd/Bp/Bt : 5-10-1989 / Nalasopara / 10:10 am
Appearance : Fair * **Height** : 5'-10"
Education : Master of Science in Electrical Eng.
 San Jose State University, California, USA
 B.E. (Electronics)
 D. J. Sanghvi College of Eng., Mumbai
 Diploma in Industrial Electronics,
 Vivekanand College, Chembur, Mumbai
Work : Corporate Application Engineer II, at Synopsys Inc. Sunnyvale, CA, USA
Email : nemish89@gmail.com
Visa Status: H1-B
Hobbies : Music, Travelling, Driving, Playing Cricket
Caste : Shree Sorath Visha Shrimali Jain Samaj
Religion : Shwetambar Murtipujak Jain
Native : Vanthli Sorath (Dist. Junagadh)
Gr. Father : Dwarkadas Kunverji Vora
Gr. Mother : Jashwanti Dwarkadas Vora
Father : Vinod Dwarkadas Vora
Occupation: Stationery Printing, Shivaji Nagar, Govandi
Email : dollyprint@gmail.com
Mother : Heena Vinod Vora
Sibling : Khyati Hiral Shah
 (Married to Hiral Bharat Shah, Dhrangadhra)
 Mumbai : Cell: 9819216137
Email : khyati_vr@yahoo.com
Mosal : Rashmin Amratlal Vanechand Patva
 Pallavi Arts, 46, Old Hanuman Lane,
 Mumbai. Cell : 9821580130
Residence : 503-A, Sai Darshan, Garden Lane,
 Sanghani Estate, Ghatkopar (West),
 Mumbai - 400 086. Tel.: 25004042
Cell : 09819026223 / 09819355774

ADVT.

NOTE : I will be in India from Nov. 29 to Dec 27, 2014

BIO DATA



Name : HIRAL NILESH SHAH
Bd/Bp/Bt : 16.09.1990 / Mumbai / 7:46 AM
Ht/Wt : 5'-1" / 45 kgs
Religion : Ghoghari Jain
Native : Bhavnagar
Education : Chartered Accountant from ICAI
Occupation: Tax Manager in Pharma Co.
 (Off. Add. Indiabulls Finance
 Center Elphinstone)
Cell : 9920156960/ 9920276893
Email Id : hiralshah169@gmail.com
Father : Niles Shah
Occupation : Businessman (Distributorship and
 Retail Trade of Electrical Fans
 and Appliances – New Electric
 Co – Lohar Chawl)
Residence : 141 Samrat Ashok Bldg, 5th Floor,
 7 R G Thakkar Marg,
 Malabar Hill, Mumbai 400006
Mother : Jasmina Shah (Homemaker)
Sister : Bindi Shah
 (Student in Animation)
Gr. Father : Lt. Dilipbhai Shah
Gr. Mother: Bhartiben Shah

ADVT.

BIO DATA



Name : CHAITALI MODI
Bd/Bp/Bt : 24-10-1988-Monday / Warangal (AP) /
 11:22 am (Slight Manglik)
Education : B.Com., MBA Finance
Height : 5'-4" * **Weight :** 65 Kgs.
Religion : Sthanakvasi Jain
Employment : Project Finance, Paraxel,
 Hi-Tech, Hyderabad
FAMILY DETAILS :
Native : Rajkot (Gujarat),
 Residing at Hyderabad (AP)
Father : Shri Rashmikant Kantilal Modi
Occupation: Sanitaryware (Wholesale)
Mother : Smt. Beenaben Rashmikant Modi
Sister-Elder: Mrs. Jeenal Raj Mandevalkar (Hyderabad)
 Mrs. Shradha Chirag Sanghvi (Mumbai)
Gr. Father : Late Shri Kantilal Raichand Modi
Gr. Mother: Ganga Sw. Muktaben K. Modi
Paternal : Late Shri Jaisukhlal K. Modi
Bhaiji : (040) 2756 5922 / 94413 80790
Hyderabad : Shri Mahendra K. Modi
 (040) 2475 3164 / 98495 53164
 Shri Harshadrai K. Modi
 (040) 2756 2608 / 98490 95110
 Shri Kirtikumar K. Modi
 (040) 2756 8461 / 98491 03030
Mosal : Late Shri Laxmidhand Devchand Sheth
 M/s. Devchand Chatrabhuj Sheth
 S. D. Road, **Jalna** - 431 203 (Maharashtra)
Phone : (02482) 234449, 233349, 08806663349
CONTACT DETAILS :
Office Add.: M/s. Modi Ceramics, 4-1-586/B, 2nd Floor,
 Troop Bazar, Hyderabad (A.P.)
 Phone : (040) 2461 0791 / 98490 33515
Residence : Arihant Darshan, Flat # 501, 3-4-218,
 Lingampally, Street No.1, Near Jain Temple,
 Kachiguda, **Hyderabad**-500 027 (AP)
 Phone : (040) 2756 3745

ADVT.

BIO DATA



Name : TEJAS MAHENDRA AJMERA
Bd/Bp/Bt : 7-12-1988 / Ghatkopar (Mumbai) / 10.55 a.m
Ht/Wt : 5'-8" / 62 kg
Education : M.S. Computer Science (Georgia Tech (Atlanta, USA))
 B.E. Computer Engineering (D. J. Sanghvi College of Engineering, Mumbai)
Profession : Software Engineer at Fact Set Research Systems Inc. (Connecticut, USA)
Visa Status : H1-B
Religion : Zalawadi Dasha Shrimali Sthanakvasi Jain
Native : Vinchhiya
Email : tejasajmera88@gmail.com

FAMILY DETAILS :

Gr. Father : Late Ratilal Dhanjibhai Ajmera
Gr. Mother : Jaswantiben Ratilal Ajmera
Father : Mahenrda Ratilal Ajmera
Occupation : Business (Dealers in Lubricants and Manufacturers of Nut Bolts)
 Mob # 9821356560

Mother : Kiran Mahendra Ajmera (Housewife)
 Mob # 9702546677

Brother : Paras Mahendra Ajmera (Elder)
 Mob # 9820223080
 Married to Neha (Daughter of Dilip Jamnadas Damani)

Mosal : Arvind Kantilal Modi (Vile Parle)
 Nitin Kantilal Modi (Vile Parle)

Residence : 140/2, Asha Bldg., Asha-Bindu Society, Garodianagar, Opp Garodia School, Ghatkopar (E), Mumbai-400 077.
 Tel.: 022-25065015

ADVT.

VISITING INDIA IN 1st WEEK OF DECEMBER

Mumbai Based having reputed Business House, Highly cultured respected Gujarati Jain Family Invites proposals for their Well educated, Beautiful, Smart, Intelligent, 26 Yr, 5'-1", Daughter from Well Educated, Well Settled, Smart Industrialist/ Business House, MUMBAI base JAIN GUJARATI BOYS/PARENTS

-: CONTACT :-

9821923030 / 9821923031.

E-mail: matrimonial.621@gmail.com

ADVT.

બિના દવાઈ કે સરલ ઔર સચોટ ઉપચાર સે, રજવાડી ઠાઠ સે જીને કી કલા

◆ હાર્ટ બ્લોકેજેસ કમ કરના ◆ કમર દર્દ ◆ સાઇટીકા કા પિડાદાયક દર્દ ◆ સ્પોડીલાઇસીસ ◆ ઘુટને કા દર્દ ◆ માર્ફિગ્રેન ◆ ડિપ્રેસન ◆ વજન ઘટાના એવં અન્ય રોગોને કે ડ્રલાજ કી સલાહ ઔર ઉપચાર કિસી ભી તરહ કી દવા દિયે બિના ઔર આપ જો દવાઈયાં લે રહે હૈ વહ બંદ કરવાયે બિના સિફ બાહ્રી ઉપચાર, બિના સાઇડ ઇફેક્ટ, નુકસાન રહિત ઔર લાભદાયક । નીચે કી અલ્ટસનેટીવ થેરેપી કા ઉપયોગ કરકે।
 મરીડીયન મસાજ થેરેપી ◆ એક્યુપ્રેસર થેરેપી ◆ પાસ થેરેપી ◆ બુહાંગ ઇનસ્ટ્રૂમેન્ટ
 ◆ સભી મરીડીયનોલેજી પર આધારિત ઔર નેચરોપથી થેરેપી કે વિશેષજ્ઞ
 આપકે ઘર આકાર તપાસ કર સહી ડ્રલાજ કિયા જાયેગા।

Raajendra S. Shah (Sr. therapist) Matunga, Mumbai.

ADVT.

Mob.: 9820002953 • Tel.: 022-24121234

લગ્નાધચુક ચુવક-ચુવતીઓની ચાદી

ચુવતી

નં.	નામ, જન્મતારીખ, ઊચાઈ, અભ્યાસ, વ્યવસાય	ધર્મ, મૂળ વતન, હાલ	સંપર્ક
૧)	પ્રિયા હર્ષદભાઈ શાહ, ૩-૧૨-૧૯૮૮, ૫'-૩'' B.Com., D.F.M., D.T.M. – સર્વિસ	ચોપન એકડા દેરા. જૈન સોજિા (ગુજ.) – અંધેરો	(ઘર) ૩૨૬૬૫૨૮૦ (મો) ૮૮૬૭૬૦૪૦૩૫
૨)	સેજલ કાંતિલાલ બોટાદરા, ૧૭-૨-૧૯૮૦, ૫'-૩'' B.Com., English Med. – (છૂટાછેડા લીધેલ છે)	જૈન નિંધિયા – દાટકોપર	(ઘર) ૨૫૦૨૭૮૬૧ (મો) ૯૭૫૭૧૫૩૮૬૧
૩)	કિંજલ ઈંદ્રવદનભાઈ શાહ, ૮-૪-૧૯૮૫, ૫'-૩'' B.E. (Mechanical) – બિઝનેસ	વિજા. સત્તા. વી. શ્રી. જૈન અજોલ-મહેસાણા – મુંબઈ	(ઘર) ૨૩૮૫૮૬૫૬ (મો) ૯૬૨૦૦૬૫૮૬૬
૪)	ચૈતાલી અરવિંદભાઈ દોશી, ૮-૬-૧૯૮૦, ૫'-૦'' B.Com., Dip. in Foreign Trade Policy – (મો.: ૯૮૮૨૨૪૭૪૦૬)	વિજા. વી. આ. શ્રી. દે. જૈન પિલવાઈ – કાંદિવલી (વે)	(ઘર) ૨૮૦૮૨૮૦૭ (મો) ૯૮૩૩૮૮૩૪૨૦
૫)	હીરવી અરવિંદભાઈ દોશી, ૧૩-૩-૧૯૮૪, ૫'-૨'' M.Com., Computer, – સર્વિસ (મો.: ૯૯૩૦૭૩૦૮૧૩)	વિજા. વી. આ. શ્રી. દે. જૈન પિલવાઈ – કાંદિવલી (વે)	(ઘર) ૨૮૦૮૨૮૦૭ (મો) ૯૮૩૩૮૮૩૪૨૦
૬)	ટ્રિંકલ ભરતભાઈ શાહ, ૧૩-૮-૧૯૮૫, ૫'-૩'' C.A., – સર્વિસ	ઘોઘારી વીસા ઓસ. જૈન સિલોર – બોરીવલી (વે)	(ઘર) ૨૨૬૩૦૬૫૨ (મો) ૯૩૨૩૧૨૧૫૬૩
૭)	S.O. ફોરમ ભરતભાઈ ગાલા, ૩૦-૦૫-૧૯૮૩, ૫'-૨'' MBBS, MD (Radiology), – સર્વિસ	કાંઠી વીસા ઓસ. જૈન સમાધોદા – સાયન (વે)	(ઘર) ૨૪૦૭૩૨૪૭ (મો) ૯૮૨૦૩૦૨૩૫૫
૮)	જવા જ્યકાંતભાઈ શાહ, ૨૨-૧-૧૯૮૫, ૫'-૪'' B.Com. (Hons.), – સર્વિસ (છૂટાછેડા લીધેલ છે)	ઘોઘારી વીસા શ્રીમાળી જૈન સિલોર – ગોરેગામ (વે)	(ઘર) ૨૮૭૫૭૫૩૪ (મો) ૯૩૨૩૩૩૪૩૦૭
૯)	દેવાંગી મહેન્દ્રભાઈ મહેતા, ૧૨-૧૦-૧૯૮૧, ૫'-૫'' B.Sc., Dip. in Public Relations & Advertising –	દશા શ્રીમાળી દિંગંબર જૈન જામનગર – બોરીવલી (વે)	(ઘર) ૨૮૯૫૦૬૦૫ (મો) ૯૮૭૯૦૪૬૨૧૨
૧૦)	દીપાલી બિપીનચંદ્ર ઝવેરી, ૨૬-૪-૧૯૭૬, ૫'-૦'' S.S.C., – (એક્યુપ્રેસરની ટ્રીટમેન્ટ આપે છે) (હળવો મંગાળ+શનિ છે)	શ્રી સુરત વી.આ.દે. જૈન સુરત – અંધેરો	— (મો) ૯૭૬૬૦૫૮૭૧૫
૧૧)	નયના જશવંતભાઈ શાહ, ૨૬-૧-૧૯૬૮, B.Com., – ઇન્વેસ્ટમેન્ટ કન્સલ્ટન્ટ (મંગાળ છે)	કાંઠા સત્તા. વી. શ્રી. જૈન આગલોડ – બોરીવલી	(ઘર) ૨૮૬૩૭૧૬૨ (મો) ૯૮૨૧૫૬૪૮૯૬
૧૨)	પિંકી અવનિશભાઈ શાહ, ૧૮-૨-૧૯૭૬, ૫'-૫'' B.Sc., DBM, – સર્વિસ (છૂટાછેડા લીધેલ છે)	દશા શ્રીમાળી દેરા. જૈન જેતપુર – મુંબઈ	— (મો) ૯૮૩૩૮૨૬૪૪૪
૧૩)	કાજલ એસ. ગોડા, ૧૮-૮-૧૯૭૬, ૫'-૫½'' B.Com., M.Com. Part I, – (મો.: ૯૮૧૬૪૫૮૭૧)	દશા શ્રીમાળી સ્થા. જૈન સરસાઈ – મલાડ (વે)	(ઘર) ૨૮૮૩૦૭૩૪ (મો) ૯૯૨૦૪૩૨૬૪૫
૧૪)	દીપા વિનયભાઈ વોરા, ૧૮-૮-૧૯૭૮, ૫'-૫'' B.Com., Diploma in Computers, –	દશા શ્રીમાળી દેરા. જૈન વેરાવળ – બોરીવલી	(ઘર) ૨૮૯૯૧૭૭૮ (મો) ૯૯૨૦૫૫૩૪૦૮

જાગૂતિ સંદેશ

ચુલાક

૧)	મિતુલ હર્પદભાઈ ઝાર્ટક્ઝિયા, ૧૬-૧૨-૧૯૮૨, પ'-૩'' B.E. Electronics, - સર્વિસ (૭ ડિસે.એ મુંબઈ આવે છે)	દશા શ્રીમાળી સ્થા. જૈન ગોપાલગ્રામ-કાંદિવલી	(ઘર) ૨૮૬૮૮૧૩૪ (મો) ૯૩૨૩૦૫૪૪૫૪
૨)	હિમાંશુ નવીનચંદ્ર શાહ, ૫-૬-૧૯૭૩, પ'-૬'' S.Y.J.C., - સર્વિસ (મંગળ છે)	વીસા ઓસ. દેરા. જૈન વડનગર - વિલે પાર્લે (ઇ)	(મો) ૯૮૩૩૩૬૫૬૦૪
૩)	સંકેત હરેશભાઈ દોશી, ૨૮-૧૧-૧૯૮૭, પ'-૭'' B.E. (EXTC), - સર્વિસ (આદિત્ય બિરલા ચુપ)	દશા શ્રીમાળી દેરા. જૈન રાજકોટ - મીરા રોડ (ઇ)	(ઘર) ૨૮૧૧૨૫૮૮ (મો) ૮૭૬૭૪૧૬૨૪૬
૪)	ભાવિન હસમુખભાઈ શાહ, ૨૮-૧-૧૯૭૬, પ'-૮'' M.B.A. Finance, - સર્વિસ (ઘર : ૨૬૧૪૮૮૬૬)	વિ.સત્તા.વીસા શ્રી.દે.જૈન માણસા - મુંબઈ	(ાં) ૬૬૩૭૨૪૮૮ (મો) ૯૩૨૪૨૪૮૮૬૬
૫)	ચેતન જશવંતલાલ શાહ, ૮-૬-૧૯૬૬, પ'-૪'' S.S.C., - બિગનેસ (છૂટાછેડા લીધેલ છે)	દશા શ્રીમાળી દેરા. જૈન વરસોડા - કાંદિવલી	(ઘર) ૨૮૦૭૦૧૫૭ (મો) ૮૪૫૪૮૧૪૭૦૮
૬)	સુકેતુ હરેન્દ્રભાઈ વોરા, ૨-૭-૧૯૬૧, પ'-૬'' B.Com., - સર્વિસ (મો: ૦૯૦૬૬૬૨૨૪૨૬)	વીસા શ્રીમાળી દેરા. જૈન વઠવાણ - જોરાવરનગર	(ઘર) ૦૨૭૫૨-૨૨૨૫૮૮ (મો) ૦૯૦૬૬૬૨૨૪૮૮
૭)	ચિરાગ હરેન્દ્રભાઈ વોરા, ૨૮-૪-૧૯૮૪, પ'-૫'' B.Com., - બિગનેસ (છૂટાછેડા લીધેલ છે) (મો: ૦૯૦૬૬૬૨૨૪૨૬)	વીસા શ્રીમાળી દેરા. જૈન વઠવાણ - જોરાવરનગર	(ઘર) ૦૨૭૫૨-૨૨૨૫૮૮ (મો) ૦૯૦૬૬૬૨૨૪૮૮
૮)	ધવલ અંધ્રિનભાઈ કોઠારી, ૨૫-૬-૧૯૮૩, પ'-૬'' B.A., - સર્વિસ (HDFC Bank-Upleta)	દશા શ્રીમાળી સ્થા. જૈન છાલ ઉપલેટા	(ઘર) ૦૨૮૨૬-૨૨૪૮૧૮ (મો) ૯૭૩૭૭૧૫૮૧૮
૯)	નીરજ રાજેન્દ્રકુમાર કોઠારી, ૪-૧૨-૧૯૮૩, પ'-૮'' B.Com., DTLP, - બિગનેસ	— છાલ ઉપલેટા	(મો) ૯૩૭૭૧૪૧૮૭૫ ૯૩૭૪૧૭૬૧૪૪
૧૦)	આશિષ મનહરલાલ બદાણી, ૨-૫-૧૯૮૪, પ'-૧૦'' B.Com., MSW, LLB, DTLP, - સર્વિસ	દશા શ્રીમાળી સ્થા. જૈન છાલ જૂનાગઢ	(મો) ૯૦૩૩૩૪૫૮૦૨ ૯૪૨૮૭૦૪૭૬૭
૧૧)	કમલેશ તનસુખલાલ દોશી, ૧-૧૨-૧૯૭૪, પ'-૬'' F.Y.B.Com., - બિગનેસ	દશા શ્રીમાળી સ્થા. જૈન જેતપુર - રાજકોટ	(મો) ૯૪૨૭૭૨૨૫૬૮ ૯૪૦૮૬૬૧૫૦૨
૧૨)	નિભિલ વિનોદભાઈ ખેતાણી, ૧૩-૨-૧૯૮૫, પ'-૬'' B.Com., C.A. Final, - સર્વિસ (હલકો મંગળ છે)	દશા શ્રીમાળી સ્થા. જૈન વિસાવદર - ઘાટકોપર	(ઘર) ૨૫૧૦૩૦૬૬ (મો) ૯૯૮૭૩૬૩૮૦૩
૧૩)	હેમંત સુરેન્દ્રભાઈ શાહ, ૩-૧૨-૧૯૮૫, પ'-૮'' B.Sc., (I.T.) M.C.A., - સર્વિસ	વીસા ઓસ. શ્રે. મૂ. પૂ. જૈન વિજાપુર - અંધેરી (વે)	(ઘર) ૨૬૨૦૪૭૬૧ (મો) ૯૦૦૪૧૮૮૩૪૧
૧૪)	જિઝેશ અનિલભાઈ દેસાઈ, ૭-૧૧-૧૯૭૮, પ'-૮'' B.Com., - બિગનેસ (લોખંડ બજારમાં)	ઘોઘારી મોટ વિનિક વૈષણવ ભાવનગર - અંધેરી (વે)	(ઘર) ૨૬૨૮૫૩૩૧ (મો) ૯૭૫૭૧૬૭૫૪૮
૧૫)	ચેતન હસમુખભાઈ શાહ, ૨૮-૭-૧૯૭૫, પ'-૬'' B.Com., - બિગનેસ (ગાર્મનટ) (છૂટાછેડા લીધેલ છે)	વીસા શ્રીમાળી દેરા. જૈન બોટાદ - બોરીવલી	(ઘર) ૨૮૦૮૪૪૩૫ (મો) ૯૮૧૬૬૫૭૦૪૬


**INCREASE
STORAGE
CAPACITY
100%
by**



KOMPRESS COMPACTORS

Kompress Range of Products

- Compactors ● Pallet Racking ● Locker / Filing Cabinets ● Heavy Duty Mobile Racking ● Shelving Systems
- Drive-In / Drive through Racking ● Multi-tier Racking ● FIFO / LIFO Racking ● AS/RS & Mini-Load Systems
- Pallet Shuttle ● Automated Guided Vehicle (AGV) ● Logistics Support Software Solutionn ● Pallet Trucks / Stackers ● Forklifts ● Reach Trucks ● Order Picker



HUMMOCK VILLAS

KHANDALA

44 Independent
Luxurious & Lake Facing Villas
on Top of the Hill



- Fully Furnished Sample Villa Ready
- Project Nearing Completion
- Villa Starts from 3 Cr. Onwards



Amenities

- | | | |
|--|---|----------------------------|
| • Spa with Steam, Jacuzzi | • Fully Equipped Clubhouse | • Lift in every bungalow |
| • Italian Marble flooring in entire bungalow | • Swimming pool with kids pool | • Reading Lounge |
| • 40000 sqft of Landscape garden | • Indoor games area for Carrom, Chess, Table Tennis | • Multi-purpose hall |
| • Children play area & jogging track | • Snooker & Pool | • Library |
| • Bath tub in Master Bed Room | • Yoga & meditation hall | • Cafeteria |
| • Glass Shower cubical in other toilets | • State-of-the-art Gymnasium with Aerobics | • In-house Buggie Facility |

Corporate Address

SHAH SOMPURA & COMPANY

901, Krushal Commercial Tower,
Next to Shoppers Stop, Amar Mahal,
Chembur (E), Mumbai - 400 089.

Tel. : +91 22 2528 5757

Mobile: +91-7875677331 / +91-98218 75757

Site Address:

Hill Top,
Near Government Guest house &
Khandala Lake, Khandala.

E-mail.

info@hummockvillas.com

sales@hummockvillas.com

Website:

www.hummockvillas.com

ADVT